

# શ્રી સ્વામી શિવાનંદજી મહારાજની પ્રેરણાથી પ્રકાશિત

## દિવ્ય જીવન

વર્ષ: ૪

અંક: ૧૧

નવેમ્બર-૨૦૦૭

સંસ્થાપક અને આધ્યાત્મિક:

બ્રહ્મલીન શ્રી સ્વામી યાશવલ્લયાનંદજી  
(ડૉ. શિવાનંદ અધ્યયુજ્ઞ)

સંપાદક મંડળ

શ્રી સ્વામી અધ્યાત્માનંદજી

ડૉ. મફતલાલ જે. પટેલી

ડૉ. હરીશ દ્વિવેદી

●

લેખ મોકલવાનું સરનામું :

તંત્રિશ્રી : ડૉ. મફતલાલ જે. પટેલી  
૪, વિશ્વભારતી સોસાઇટી,  
નવરંગપુરા ટેલિફોન ટાવર પાસે,  
અમદાવાદ-૩૮૦ ૦૦૬  
ફોન : ૨૬૪૦૮૪૦૬

●

મુખ્ય કાર્યાલય :

'દિવ્ય જીવન' માસિક, તેમનું લવાજમ :

સ્વામીચિદાનંદ સર્વજીવસેવાનિધિ  
ઈતર પત્રવ્યવહાર અને મહામંત્રીનું કાર્યાલય :  
ગુજરાત દિવ્ય જીવન સંઘ  
શિવાનંદ આશ્રમ,  
જોધપુર ટેકરી, શિવાનંદ માર્ગ,  
અમદાવાદ-૩૮૦૦૧૫  
ફોન : ૨૬૮૬૧૨૩૪  
ટેલિફેક્સ : ૨૬૮૬૨૩૪૫

●

E-mail :

sivananda\_ashram@yahoo.com

Website : <http://divyajivan.org>

### લવાજમ

મારતમાં

વાર્ષિક લવાજમ : રૂ. ૧૦૦/-  
શુભેચ્છક લવાજમ : રૂ. ૧૦૦૦/-  
(૧૫ વર્ષ માટે)

પેટ્રન લવાજમ : રૂ. ૨૫૦૦/-  
ધૂટક નકલ : રૂ. ૧૦/-

વિદેશ માટે:

વાર્ષિક \$ 12 અથવા £8 (એર મેઈલ)  
પેટ્રન \$ 250 અથવા £160 (એર મેઈલ)  
ફેક્સ ડ્રાફ્ટ (અમદાવાદ) દ્વારા

૩૫

ॐ અક્ષસ્ત્રક્પરશું ગદેષુકુલિશં પવં ધનુષ્કુણ્ડકાં  
દણ્ડં શક્તિમસિં ચ ચર્મ-જલજં ઘણ્ટાં સુરાભાજનમ् ।  
શૂલં પાશસુરદર્શને ચ દધતીં હસ્તૈઃ પ્રસન્નાનનાં  
સેવે સૈરિભર્મર્દ્દિનીમિહ મહાલક્ષ્મીં સરોજસ્થિતામ् ॥

હું કમળના આસન ઉપર બેઠેલી, પ્રસન્ન મુખવાળી,  
મહિષાસુરમર્દ્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું. તેના હાથમાં  
અક્ષમાળા, ફરસી, ગાઢા, બાણ, વજ, પદ્મ, ધનુષ, કુણિકા, દંડ,  
શક્તિ, ખડુગ, ઢાલ, શંખ, ધંટા, મધુપાત્ર, શૂલ, પાશ અને ચક્ર  
ધારણ કરેલાં છે.

**શિવાનંદ વાણી**  
**આદ્ધારશુદ્ધિ વિના આત્મજ્ઞાનમાં પ્રગતિ થઈ**  
**શક્તી નથી.**

શુદ્ધ મન શુદ્ધ આદ્ધારમાંથી બને છે. મન આદ્ધારનો સૂક્ષ્મતમ અંશ  
છે. ખોરાકને પ્રક્રિયાના અભ્યાસ સાથે ધણો નિકટનો સંબંધ છે. પૂર્ણ આદ્ધાર,  
પવિત્ર ભોજન, અરધું પેટ પાણીથી ભરવું - એ તદ્દન આરોગ્યપ્રદ અને  
સાંપ્રત વિજ્ઞાનના આરોગ્યના નિયમોની સાથે સંવાદિત છે.

આદ્ધાર સાદો ૪ હોવો જોઈએ. ભોજન તેજાનાઓ રહિત, પીડા  
રહિત, અનુતેજક, હોજરીની ભૂખ દૂર કરે તેવું અને સ્વાદિષ્ટ હોવું જોઈએ.  
તમે ભૂખ્યા હો ત્યારે ૪ જમો. તાજાં ફળો, શેરડી, મધ, દૂધ, માખણ,  
કોપરું, બદામ, ચીજ, જવ, મકાઈ, ઘઉં, ટામેટા, લીલા ચણા, કોબીજ,  
બટાકા એ આદ્ધાર માટે શુદ્ધ છે. ગરમ દાળ, ઝતુ વીતી ગયા પણીની  
વાનગીઓ, મસાલા, ચટણીઓ, મચ્છી-માંસ, ઈંડાં, આંબલી, રાઈ, કુંગળી,  
લસણા, હીંગ, મીહું, રીંગણા, અથાણાં, તેલમાં તળેલી વાની, કેક, તમાકુ,  
દારુ અને નાકોટિક ડ્રોસ - એ બધાં મનને અશુદ્ધ અને બેચેન બનાવે છે.  
તેમનો ત્યાગ કરવો જોઈએ.

- સ્વામી શિવાનંદ

**પ્રકાશક-મુદ્રક :** શ્રી સુમંતરાય સી. દેસાઈ વતી માલિક ગુજરાત દિવ્ય જીવન સંઘ દ્વારા પ્રિન્ટ વિઝન પ્રિન્ટ, અંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ પ્રેસ ખાતે છિપાવી શિવાનંદ આશ્રમ, જોધપુર ટેકરી, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦ ૦૧૫થી પ્રકાશિત કર્યું.

## અનુકમ

|                                       |                                    |    |
|---------------------------------------|------------------------------------|----|
| ૧. શલોક                               | .....                              | ૧  |
| ૨. અનુકમ, તહેવાર સૂચિ                 | .....                              | ૨  |
| ૩. સંપાદકીય                           | સંપાદક                             | ૩  |
| ૪. યોગનો પરિચય-૨                      | ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી      | ૪  |
| ૫. ગુરુદેવનો વારસ - સ્વામી ચિદાનંદ    | શ્રી સ્વામી ચૈતન્યાનંદજી           | ૭  |
| ૬. મનાચે શલોક - મનોબોધ                | શ્રી સ્વામી અધ્યાત્માનંદજી         | ૮  |
| ૭. શાંતિનો વ્યવહારું અભિગમ            | શ્રી યોગેશ્વર                      | ૧૦ |
| ૮. યોગ એ જ જીવન (૩)                   | શ્રી સ્વામી અધ્યાત્માનંદજી         | ૧૧ |
| ૯. એકાગ્રતા અને ધ્યાન                 | શ્રી સ્વામી નિખિલેશ્વરાનંદજી       | ૧૪ |
| ૧૦. મૂર્તિપૂજા                        | શ્રેદ્ધેય પાંડુરંગશાક્તી આદ્ધરલેજી | ૧૮ |
| ૧૧. સદ્ગ્રાણી                         | શ્રી શ્રી મા આનંદમથી               | ૨૦ |
| ૧૨. પ્રસંગ-વાર્તા                     | પપા સ્વામી રામદાસ                  | ૨૧ |
| ૧૩. ઉપનિષદ-યાત્રા                     | શ્રી ગુણવંતભાઈ શાહ                 | ૨૨ |
| ૧૪. ઉઘમો ભૈરવ:                        | શ્રી દિગંબર સ્વાદિયા               | ૨૪ |
| ૧૫. મહાકાળી                           | —                                  | ૨૫ |
| ૧૬. શ્રી ચૈતન્ય મહાપ્રભુ-જીવન પ્રસંગો | શ્રી કનેયાલાલ મ. પંજ્યા            | ૨૬ |
| ૧૭. પ્રત્યેક દિવસ, એક નવી શરૂઆત       | ડૉ. હરીશ દ્વિવેદી                  | ૨૮ |
| ૧૮. વૃત્તાંત                          | .....                              | ૩૦ |

## તહેવાર સૂચિ

નવેમ્બર, ૨૦૦૭

### તા. તિથિ (આસો વદ)

|                    |   |
|--------------------|---|
| ૫                  | ૧૧ એકાદશી   |
| ૭                  | ૧૩ પ્રદોષપૂજા-ધનતેરસ                                  |
| ૮                  | ૧૪ નરક ચતુર્દશી-કાળી ચૌદસ                             |
| ૯                  | ૩૦ અમાવસ્યા-દીપાવલી                                   |
| <b>(કારતક સુદ)</b> |   |
| ૧૦                 | ૧ નૂતન વર્ષ, શ્રી ગોવર્ધન પૂજા,                       |
|                    | શ્રી ગોપૂજા, શ્રી બલીપૂજા                             |
| ૧૬                 | ૬ શ્રી સ્કંદપાષણ                                      |
| ૧૭                 | ૮ શ્રી ગોપાષણી  |
| ૨૦                 | ૧૧ એકાદશી (પ્રબોધિની)                                 |
| ૨૧                 | ૧૨ શ્રી તુલસીપૂજા, ઉત્થાન દ્વાદશી, ચાતુમસ યાત્રા પૂરી |
| ૨૨                 | ૧૩ પ્રદોષપૂજા   |
| ૨૩                 | ૧૪ શ્રી વૈકુંઠ ચતુર્દશી                               |
| ૨૪                 | ૧૫ પૂર્ણિમા, શ્રી ગુરુનાનાક જયંતી                     |

### ● ગુરુદેવ સ્વામી શિવાનંદજીનો ઘડંગયોગ ●

### ● સેવા ● પ્રેમ ● દાન ● પવિત્રતા ● ધ્યાન ● સાક્ષાત્કાર

#### આત્મામાં આનંદ અનુભવો

ગાઢ પ્રવૃત્તિની કિંદળી જીવો. હંમેશાં મનને શાંત રાખો. તમારા મંત્રનો માનસિક જ્યો કરો. સર્વની સાથે મળો. સર્વને ભગવાનનાં રૂપો જ્ઞાની તે બધાંની સેવા કરો. આધ્યાત્મિક પથમાં મુશ્કેલીઓ અને નિર્ઝળતાઓથી ડરો નહિ. મુશ્કેલીઓ તમારી ઈચ્છાશક્તિનો વિકસ કરશે. તમારાં બુદ્ધિ, વ્યાવહારિક શાક્ષાપણ અને સામાન્ય સ્નોઝનો ઉપયોગ કરો. તમે એક પણ મુશ્કેલીઓને તરી જશો. સચેત રહો. તમે એજેય છો. તમને કોઈ પણ નુકસાન કરી શકશે નહિ. હંમેશાં શાંત રહો. હસતા રહો અને આત્મામાં આનંદ અનુભવો.

- સ્વામી શિવાનંદ

#### “અનુરોધ-અભિલાષા” ગ્રાહકોને :

- સ્વાનગી સરળતા માટે આપનું પત્રઅભારાનું સરનાયું પિનનોડ સાથે સંપૂર્ણ હોય તે ઈચ્છનીય છે.
- આપનો ગ્રાહક નંબર નોંધી લેવા વિનંતી છે, જેથી અંકની પ્રાપ્તિ સંબંધી કોઈ પણ પત્રઅભાર કરતી વેળા ગ્રાહક નંબરનો ઉત્તેખ વહીવટી સરળતા સર્જ શકે છે.
- સામાચર્યત: દર માસની પાંચમી તારીખે અંક પ્રસિદ્ધ થયા બાદ તેની સ્વાનગીનું ક્રમ શરૂ થાય છે. ઇતાં કોઈ ખાસ કારણોસર પ્રકાશનની નિર્ધારિત તારીખના ૧૦ દિવસ વીત્યે પણ જો આપને અંક ન મળે તો સ્થાનિક ટપાલ કરેશે તો તપાસ કર્યા બાદ વહીવટી કાર્યાલયને જગ્જાવવું. સિલકમાં ડશે તો બીજો અંક મોકલાશે.
- ‘દિવ્ય જીવન’ની સામગ્રી આપને ગમી હશે. તેથી હવે આપનાં પરિચિત વર્તુળોમાં પણ તેની રસલ્લાણ થાય અને ગ્રાહકવૃદ્ધિમાં આપનો નક્કર સહયોગ અમને મળતો રહે તેવી અભિલાષા છે.
- અમદાવાદ સિવાયના ગ્રાહકોએ પોતાનું લવાજમ ડ્રાઇટ અગર મનીઓરથી જ મોકલવું.

## દિવ્ય સ્કુલિંગ

**અંધકારમાં રહીને પણ પ્રકાશમાં રહો :** મહાપુરુષોનાં વિધાનો ‘સત્ય’નું પ્રકટીકરણ છે. તેમનાં વચ્ચનો શાશ્વત તત્ત્વનાં વચ્ચનો છે. આપણે જાણવું જોઈએ કે આપણે આપણી આસપાસના અંધકારભર્યી જગતમાં રહીને પણ પ્રકાશમાં જીવીએ છીએ, કારણ કે સતત બદલાતા જગતની પાછળ અને તેને પેલે પાર અદશ્ય વાસ્તવિકતા રહેલી છે. આપણે આ સત્યમાં જ જીવવું જોઈએ.

- સ્વામી ચિદાનંદ

## સંપાદકીય



### દીપોત્સવ - આત્મોલ્લાસનું પર્વ

દીપોત્સવ ! આત્મોલ્લાસનું પર્વ. દીવડા એટલે પ્રકાશનું માધ્યમ. પ્રકાશ એટલે અંધકારનો અભાવ. શુતિઓ જ્ઞાનને પ્રકાશ અને અજ્ઞાનને અંધકાર કહે છે. અર્થાત્ દીપોત્સવ એટલે જ્ઞાન, પ્રકાશ અને વિકાસનું પર્વ.

દીપક એ આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. આત્માનું સ્વરૂપ આલોક છે. આત્માનું સ્વરૂપ આનંદ છે. આત્માનું સ્વરૂપ ગ્રજા છે. આત્મા નિત્ય, સત્ય, શુદ્ધ, બુદ્ધ, શાશ્વત અને ચિરંતન છે, માટે જ આત્માનું વર્ણન કરતાં કઠોપનિષદ કહે છે :

ન તત્ત્વ સૂર્યો ભાતિ ન ચંદ્રતારકં નેમા વિવૃતો ભાતિ કુલોડ્યમાર્ગિઃ ।  
તમેવ ભાન્તમનુભાતિ સર્વ તસ્ય ભાસા સર્વમિંદ વિભાતિ ॥

(કઠોપનિષદ : ૨:૫:૧૬)

આત્માનું સ્વરૂપ દિવ્ય છે. ભવ્ય છે. જ્ઞાનમય, વિજ્ઞાનમય, ચૈતન્યમય. ત્યાં કોઈ પણ સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી કે પ્રકાશ ચમકી શકે નહીં. આત્માના પ્રકાશથી જ સમગ્ર બ્રહ્માંડ પ્રકાશિત છે. આત્માના શબ્દ માત્રથી જ સમગ્ર સૂચિ ટકી રહી છે. તે જ આત્મા જ્યોતિઓની જ્યોતિ છે. આમ આ દીપાવલી આત્મઉત્કર્ષનું, આત્મજાગૃતિનું, આત્મનિરીક્ષણનું અને આત્મપરીક્ષણનું પર્વ છે.

અને તે પછીની જે દિવ્ય અનુભૂતિ થાય છે તે અલૌકિક છે. તૈત્તિરીયોપનિષદની બ્રહ્મવલ્લીના નવમા અનુવાકમાં આ દિવ્ય અનુભૂતિનું વર્ણન છે.

“યતો વાચો નિવર્તને અપાય મનસા સહ ।

આનંદ બ્રહ્મણો વિદ્વાન્ ન બિભેતિ કુતશ્ચનેતિ ॥”

ત્યાં વાણી વિરામ લે છે. મન આનંદ બ્રહ્મમાં વિલાસ કરે છે એવો વિદ્વાનોનો અનુભવ છે, કારણ કે આ આત્મતત્ત્વ જ સ્વયં બ્રહ્મ છે. ‘અયમ્ આત્મા બ્રહ્મ.’

જે દીપકોની આપણે આરાધના કરીએ છીએ, તે પરબ્રહ્મ જ્યોતિમાંથી સૂચિસંચાર થયો છે. પહેલાં આકાશ પછી વાયુ, તેજ, જળ, પૃથ્વી, ઓષધી, રેતસ્ય અને માનવનો પ્રાદુર્ભાવ, તેથી જ માનવ સ-રસ થયો. તૈત્તિરીય પ્રશ્ન કહે છે;

“તસ્માદ્વા અનેતસ્માદ્વાન આકાશઃ સંભૂતઃ । આકાશાદ્વાયુઃ । વાયોરાજિઃ । અગ્નેરાપઃ । અદ્ભૂત્ય: પૃથ્વી ।  
પૃથ્વીયા ઓષધયઃ । ઓષધીભ્યોડત્તમ્ । અસ્ત્રાત્રેતઃ । રેતસ: પુરુષ: । સ વા એવ પુરુષોઽત્તરસમયઃ ॥”

આપણી દિવાળી એટલે ચોપડાપૂજન ! આખાયે વર્ષનું લેખુંઝોખું. જીવન જંઝાને ઓવારે થયેલાં શુભ-અશુભ કર્મોના એકરારનું પર્વ. જૂના હિસાબની માંડવાળ. નવા ચોપડાથી નવવર્ષનો પ્રારંભ. ગત વર્ષની ભૂલોનું પુનરાવર્તન ન થાય, ભૂલોના સરવાળા ન થાય, માટે આવશ્યક પશ્ચાત્તાપ. ભૂલોની ભુલામણીમાં ભરમાઈ ન જવાય, ભ્રમિત જીવ ભવાટવીને ભવબંધને ન બંધાય માટે સતર્કતા-સાવધાનીનું પર્વ !

જીવન કવનની વિધિમાં માર્ગો અટપટા હોય, આરોહ-અવરોહ પણ ખરા જ. અહીં In all conditions, I am bliss bliss Absolute ! નું સાર્થક્ય એટલે જ ખરા અર્થમાં દીપોત્સવ !

પરસ્પર પ્રેમ ! પરસ્પર સહૃદાય ! પરસ્પર સન્નાન અને ન્યોછાવરની ભાવના એટલે દિવાળી. નરકાસુરનો વધ એટલે આપણે હૈયે ઢબુરાયેલાં વૈમનસ્યનાં વમળોનું શુદ્ધીકરણ. ‘કૂડા કામ કોધને પરહરો રે દિલમાં દીવો કરો.’ સાચા અર્થમાં સંવત્સરી ! મિશ્યામી હુક્કડમ્ !!!

આમ દીપોત્સવ એટલે આંતરજાગરણનું પર્વ. દીપોત્સવ એટલે આંતરશુદ્ધિનું પર્વ. દીપોત્સવ એટલે અનેકતામાં એકતાનું પર્વ. દીપોત્સવ એટલે ‘હું’ ‘તું’થી પર મારાં તારાંથી પૃથ્વી ‘એક તું એક તું’ના જીવનસાર્થક્યનું પર્વ ! નૂતન અભિવાષાઓની પૂર્તિનું પર્વ. આત્મોલ્લાસનું પર્વ ! અભિનંદનોની સરવાણીનું પર્વ ! ઊં શાંતિ.’

- સંપાદક

## યોગનો પરિચય - ૨

ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી



【સ્વામી શિવાનંદ જ્ઞાનયજ્ઞ નિધિ પ્રકાશિત શ્રી સ્વામી શિવાનંદજીનાં લખાણો અને ઉપદેશો પર આધારિત 'યોગના પાઠો'માંથી સાભાર (સૌજન્ય : ધી ડિવાઈન લાઈફ સોસાયટી - સાઉથ આફિક્ઝ)】

### યોગશિક્ષણ :

તમારા શિક્ષણ સાથે યોગનું શિક્ષણ તમને પૂર્ણ આદર્શ યુવાન કે યુવતી બનાવશે.

યોગશિક્ષણ તમને નેતિક રીતે પુણ્ય બનાવશે. તે તમને દુનિયા પર પ્રકાશ અને શુભેચ્છાઓ ફેંકતી દીવાદારી બનાવશે. તે તમને ઉમદા આકંસ્કાઓ અને પવિત્ર મૂલ્યોથી ભરી દેશે. યાદ રાખો કે શિક્ષણનો સાચો અર્થ ડિગ્રી કે નોકરી મેળવવાનો નથી કે તમારા નામ પાછળ ડિગ્રીના અક્ષરોની હારમાળા કરવાનો નથી; પણ તમારા મન અને આત્માને પ્રબુદ્ધ કરવાનો છે.

યોગશિક્ષણ જીવનની સમસ્યાઓનો બહાદુરી અને હિંમતથી સામનો કરવા માટે તમને તૈયાર કરશે. તે તમને શ્રેષ્ઠ કોટિની ચારિત્રશીલ વ્યક્તિ બનાવશે. તે તમારા મનની બધી અશુદ્ધિઓ અને નિર્ભિજતાઓને દૂર કરી તમારા આત્માને શુદ્ધ અને ઉમદા બનાવશે.

તે તમારામાં કુટુંબના અને સમાજના સભ્યો અને રાષ્ટ્ર તેમ જ વિશ્વના નાગરિકો પ્રત્યેની જવાબદારીની ભાવનાનો વિકાસ કરાવશે.

યોગ તમને વિશાળ દાખિલિદુ આપશે, તેથી આ વિશ્વના બધા લોકો તમારાં ભાઈ કે બહેન છે તેમ તમને લાગશે. આને 'વૈશ્વિક ભાઈયારો' કહેવામાં આવે છે. તમે હવે જન્મની કે ધર્માધ રહેશો નહિ. તમે બધા લોકોને બધાં રાષ્ટ્રોને, બધાં પંખીઓ તથા પશુઓને, બધા સંપ્રદાયો, ધર્મો અને પંથોને સરખી રીતે ચાહશો અને આદર કરશો.

જીવનનું શ્રેષ્ઠ શિક્ષણ એ છે કે જે તમને શુદ્ધ પ્રેમ, સહનશીલતા, શ્રદ્ધા, ભક્તિ, ધીરજ, નિઃસ્વાર્થતા અને દયાથી ભરી દે. યોગથી તમારામાં આ બધા દૈવી ગુણોનો વિકાસ થશે. તમારી ખરેખરી પ્રગતિ આ ગુણોના વિકાસમાં રહેલી છે. જો તમે આધ્યાત્મિક રીતે વિકાસ પામશો તો તમે રાષ્ટ્રને માટે પણ એક સાચી સંપત્તિ સાબિત થશો.

યોગનું શિક્ષણ જીવન જીવવા માટે જરૂરી

કળાની તાલીમ છે. તે તમારામાં જે કંઈ શ્રેષ્ઠ છે તેને બહાર લાવે છે. તે તમને સંસ્કારી બનાવે છે, તે તમને પશુની કક્ષામાંથી ઊંચે ઈશ્વરની કક્ષા પર લઈ જાય છે. તે તમને જવાબદારીની સૂર્જ બક્ષે છે, જેથી આજે ખૂબ પ્રચલિત ગુંડાગીરી અને અશિસ્તના તમે ભોગ ન બનો. યોગની તાલીમ તમને શિસ્તબદ્ધ, પ્રેમાળ, માયાળું, સાચી રીતભાતવાળા અને દિલસોજ બનાવશે.

છેલ્લે, યોગનું શિક્ષણ તમારા સામાન્ય શિક્ષણમાં પણ ઉપયોગી નિવિદશે. દાખલા તરીકે, યોગસનોનો અભ્યાસ અને બ્રહ્મચર્યનું પાલન તમને પ્રયંડ શક્તિ, સુસ્પષ્ટ સમજશક્તિ, પ્રબળ યાદદાસ્ત અને તીવ્ર બુદ્ધિ આપશે. બધા વિદ્યાર્થીઓ માટે બ્રહ્મચર્ય ખૂબ જરૂરી હોવાથી ફરજિયાત છે. તમારો સ્વભાવ આનંદી તથા હસમુખો થશે.

### કૃત :

જેવી રીતે તમારે સ્કૂલ કે કોલેજના વિષયો શીખવા માટે શિક્ષક કે પ્રાચ્યાપકની જરૂર પડે છે, તે જ પ્રમાણે યોગવિજ્ઞાન શીખવા માટે તમારે શિક્ષક હોવો જોઈએ. યોગશિક્ષકને ગુરુ કહેવામાં આવે છે. બરાબર યાદ રાખો કે વહેલા યા મોડા તમારે યોગવિજ્ઞાનના નિષ્ણાત કોઈ ગુરુ પાસે જઈ તેની સીધી રાહબરી નીચે યોગનું શિક્ષણ લેવું પડશે.

મનમાં સમજવાની એક મહત્વની વાત એ છે કે આપણે ગુરુ પાસે નમ્રભાવે અને શીખવાની ઉત્કર્ષ સાથે જરૂર જોઈએ. આજના શિક્ષિત વિદ્યાર્થીઓને ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધનો કોઈ જ્યાલ હોતો નથી. કેટલાક તો ગુરુની પાસે આદર અને નમ્રતા સાથે જવાને બદલે આજના અપટુટે શિષ્યો પોતે જ પોતાના પર લાદેલી મહત્તમાના તોરમાં ખિસ્સામાં હાથ રાખીને જાય છે. આપણા સ્કૂલના શિક્ષકો પાસે પણ આવી મનોવૃત્તિ સાથે જઈ ન શકાય.

ગીતા કહે છે કે પ્રણિપાત, નમ્રતા, સેવા અને પૃથ્વી દ્વારા યોગનું ગૌરવશીલ વિજ્ઞાન આપણે પૂજય

અને આદરણીય શુરુનાં વચ્નો દ્વારા શીખવું જોઈએ.

### યોગનો પાયો નૈતિક તાલીમ :

આજે આધ્યાત્મિક પથના ઘણા જિજ્ઞાસુઓ યોગનો પાયો મજબૂત કર્યો વગર, ધ્યાન, કુંડલિની યોગ અને એવી બીજી મુશ્કેલ પદ્ધતિ જેવા યોગના અગ્રિમ માર્ગો પર સીધા ફૂફ્ટી પડે છે. તેનાથી ફક્ત મહાઅનર્થ જ થાય છે. જ્યારે વિદ્યાર્થી ભણવાનું શરૂ કરે ત્યારે તેને સીધા દસમા ધોરણમાં દાખલ કરે છે? ના, તમારે કમશા: આગળ વધવાનું હોય છે. તે જ પ્રમાણે યોગમાં પણ તમારે કમશા: પ્રગતિ કરવાની છે.

આપણે આગળ જોઈ ગયા કે યોગની ઘણી શાખાઓ, તેમ જ ઘણી વિવિધ પ્રકારની યોગપદ્ધતિઓ છે, પણ દરેક વ્યક્તિને આ બધી માફક આવતી નથી. હવે, આ બધી યોગની પદ્ધતિઓમાં અપવાદ સિવાય એક સમાન શિસ્તનું આચરણ કરવાનું હોય છે. તે સમાન શિસ્ત છે નૈતિક તાલીમ. જેમ વૃક્ષની બધી શાખાઓ અને પ્રશાખાઓ વૃક્ષના થડમાંથી બહાર આવે છે, તે જ પ્રમાણે યોગનું મુખ્ય થડ નૈતિક શિસ્ત છે.

નૈતિક તાલીમ વ્યક્તિનું સદ્ગુણોથી સભર સુદૃઢ ચારિએ ઘડે છે. સારા શુદ્ધ ચારિએથી આપણામાં સારી રીતભાત અને સારી વર્તણૂક આવે છે.

નૈતિકતાનું આટલું બધું મહત્વ કેમ છે? યાદ રાખો યોગનો ઉદ્દેશ આપણને ઈશ્વર સાથે જોડવાનો છે. હવે ઈશ્વર બધી વસ્તુઓમાં અને દરેક પ્રાણીમાં રહેલો છે. જો આપણે આ ધરતી પરનાં દરેક પ્રાણીને ચાહી ન શકીએ તો ઈશ્વરને પણ સાચી રીતે ચાહી ન શકીએ. હવે, જો આપણે ઈશ્વરની સૃષ્ટિનાં બધાં સર્જનો સાથે પ્રેમ વિકસાવીએ તો તેમને મારી નાખવાનું તો એક બાજુએ રહ્યું પણ આપણે તેમને ઈજા કરવાનું કે તેને દુઃખી કરવાનું પણ ન વિચારીએ. ઈશ્વર દરેકમાં હોવાથી આપણે કોઈને છેતરીએ નહીં. ઈશ્વર આપણા વિચારો જાણતો હોવાથી આપણે ખોટું પણ બોલીએ નહીં.

અહીંસા, સત્ય, અસ્તેય અને હૃદયની પવિત્રતાનું આચરણ નૈતિક શિસ્ત કહેવાય છે. યોગની કોઈ પણ શાખામાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે આ સદ્ગુણોને આચરણમાં પૂરેપૂરા ઉતારવા જોઈએ. તેમના વગર યોગમાં આપણે ભાગ્યે જ કંઈ પ્રગતિ કરી શકશું. નદીના કંઠે લંગર નાખેલી હોડીને હલેસાં દ્વારા

ચલાવવા જેવું થાય.

ઉપરની બધી ચેતવણીઓ આપવા છતાં એક તરફ દુર્લક્ષ કરી ઘણા હજુ પણ યોગનો અભ્યાસ કરે છે અને મહાન સંત અને મહાત્માની જેમ ડોળ રાખે છે. આજના યોગના જગતનાં ખેદકારક સત્યોમાંનું આ એક છે. આવા લોકોનો હેતુ અશુદ્ધ હોવાથી તેઓ નૈતિક પૂર્ણતાની અવગણા કરે છે. યોગીઓને પ્રસિદ્ધ અને કીર્તિ ખૂબ મળે છે, યોગની દુનિયાની મોહિની પણ ઘણી છે. વળી, મહત્વાકંક્ષી લોકો ઘણા શિષ્યો કરી અને આશ્રમો સ્થાપી એશારામી જીવન ગાળતા હોય છે. યોગીઓ આ લાલચોના શિકાર બની જાય છે. દુન્યવી ભોગોના તોફાનમાં તેઓ ખેંચાઈ જાય છે અને તેમણે જે હેતુ માટે યોગ શરૂ કર્યો હતો તે ભુલાઈ જાય છે. આવી ભૂલો ન બને તે માટે આપણે આજે અને સદા ખૂબ સજાગ રહેવું જોઈએ.

માટે, સદ્ગુણોના ઉપાર્જનમાં અને દુર્ગુણોનું નિકંદન કરવામાં સહેજ પણ બેધ્યાન ન થતા. આપણા યોગના અભ્યાસ દરમિયાન આ બાબતમાં પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ.

### યોગના પંથ - સમાજની મુશ્કેલી :

દરિયાકંઠે રેતીના જેટલા કણ હોય છે એટલા દુનિયામાં પંથ છે. લોકો ધર્મના સાચા સારતત્ત્વને સમજતા નથી. તેઓ તુચ્છ માનવીઓ, બહારની ધાર્મિક વિધિઓ અને ધર્મમાં ઘૂસી ગયેલી એક્સો એક વસ્તુઓ માટે નકામા લડ્યા કરે છે. જાહેર મંચ પર એક ઉપદેશક બીજા ધર્મના ઉપદેશકને ભાડે છે. એક વિચારશ્રેષ્ઠીવાળો ઉપદેશક બીજી વિચારશ્રેષ્ઠીના દોષો તથા ખામીઓની જાહેરમાં ચર્ચા કરે છે. શિક્ષિત કહેવાતા લોકો પણ શરમ છોડીને એકબીજા સાથે બાજે છે.

આજની સ્થિતિ આવી શોચનીય છે.

તમે કેલાસ શિખર પર ઘણા વિવિધ માર્ગ દ્વારા જઈ શકો - ગંગોત્રીથી, બદરીનાથથી, જોશીમઠથી અથવા કાશ્મીરથી. માર્ગો જુદા હોવા છતાં નિર્દિષ્ટ સ્થાન એક જ છે. બધી જ નદીઓનું છેલ્લું નિર્દિષ્ટ સ્થાન સાગર છે. તમે અમદાવાદથી હણીકેશ-શિવાનંદ આશ્રમ ટ્રેન દ્વારા, બસ દ્વારા, પોતાના વાહન દ્વારા કે પ્લેન દ્વારા જઈ શકો. ગમે તે રીતે જાઓ મુકામ એક જ છે.

મન વિવિધ પ્રકારનું હોય છે. આધ્યાત્મિક

સાધના કરનાર લોકો વિવિધ વૃત્તિ, સ્વભાવ, પસંદગી અને ક્ષમતાવાળા હોય છે, માટે તેમને અનુરૂપ ઘણા વિવિધ માર્ગો જરૂરી છે.

એક વાત ખાસ નોંધવી જોઈએ કે જ્યારે આપણાં હૃદય વિશાળ બને છે ત્યારે મતમતાંતર ગૌણ બને છે અને જ્યારે ઈશ્વર-સાક્ષાત્કાર થાય છે ત્યારે મતમતાંતર જેવું કંઈ રહેતું જ નથી. ઈશ્વર-સાક્ષાત્કાર પામેલા આત્માઓ સમદર્શી હોય છે. બધાંને તેઓ સરખી રીતે ચાહે છે. તેઓ જાણો છે કે બધા જ પંથો અને સંપ્રદાયો ફક્ત ઈશ્વર તરફ આગળ વધવા માટે છે એટલે તે બધામાં તેઓ સારું જ જુએ છે.

આને વધુ સ્પષ્ટતાથી સમજવા માટે એક દાખલો લઈએ.

પાંચ આંધળા લોકો હાથી પાસે પહેલી વાર આવ્યા.

પહેલાના હાથમાં તેનો કાન આવ્યો અને કહ્યું : ‘હાથી સૂપડા જેવો છે.’

બીજાએ તેનો પગ પકડ્યો, તેણે કહ્યું : ‘હાથી થાંભલા જેવો છે.’

ત્રીજાએ હાથીની પુંછડી પકડી અને કહ્યું : ‘હાથી મોટા ચાખુક જેવો છે.’

ચોથો હાથીના શરીરને અડયો અને કહ્યું : ‘હાથી તો મોટા ખડક જેવો છે.’

છેલ્લાએ હાથીની સૂંઠ પકડી અને કહ્યું : ‘હાથી તિક્ષણ ભાલા જેવો છે.’

દરેકે પોતે કહ્યું તે સાચું છે તેમ કહી એક બીજા સાથે લડવા માંડ્યા. એક યોગી એટલામાંથી પસાર થતો હતો તેણે વાત સાંભળી. એક પણ શબ્દ બોલ્યા વગર તેણે પોતાની યોગશક્તિથી પાંચે આંધળાઓને તેમની દષ્ટિ પાછી આપી. જ્યારે પાંચે જણો આખા હાથીને જોયો ત્યારે તેઓ પોતાની મૂર્ખતા પર હસવા લાગ્યા.

આવું જ નકામી વાતો પર જોસથી જગડતા તુચ્છ મનના અજ્ઞાની અંધશ્રદ્ધાળુઓનું સમજવું.

ઈશ્વર એક છે. સદાચાર એક છે. સાચો ધર્મ પ્રેમનો ધર્મ-આત્મસાક્ષાત્કારનો ધર્મ-એક છે. સૂર્ય એક છે. ચંદ્ર એક છે. વિવિધ ભાષાઓમાં દર્શાવિલા હોવા છતાં વિચારો એક છે. કરુણા અને સચ્ચાઈ એક છે. અમેરિકન કરુણા કે જાપાની સચ્ચાઈ કે ભારતીય સદાચાર જેવું કંઈ હોઈ શકે નાહિ. વિશ્વના બધા લોકોનાં શરીર એક જ પાંચ મહાભૂતોમાંથી બનેલાં છે.

માટે આપણે વિશાળ મન કેળવવું જોઈએ અને બધા પ્રકારના લોકો સાથે સંવાદિતાથી રહેવું જોઈએ. આપણે બધા બહાદૂરીપૂર્વક આપણા લક્ષ્ય તરફ ધર્સીએ, પછી એ ગાડા દ્વારા હોય, ટ્રેન દ્વારા હોય, કાર દ્વારા હોય કે પછી જેટ પ્લેન દ્વારા હોય. આપણી જાતને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ, અનંત પરમસુખ અને શાંતિ બક્ષનાર માનવજીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે ખરા દિલથી પ્રયત્ન કરીએ.

### સમાપન :

એક જ માપનું પહેરણ બધાંને થાય નહિ. વ્યક્તિગત પસંદગી અને ક્ષમતા જુદી હોય છે, તેથી બિન પ્રકારના યોગ અને બિન ધર્મની જરૂર છે. એક ધર્મ એક પ્રકારનો યોગ બીજાના જેવો જ હોય છે. ઈશ્વર તરફ લઈ જતો કોઈ એક પથ બીજા પથ જેવો જ સક્ષમ હોય છે. ગાયોના રંગ જુદા જુદા હોવા છતાં બધાનું દૂધ એક જ રંગનું સફેદ હોય છે. શુલાબ જુદા જુદા પ્રકારનાં હોવા છતાં તેમની સુગંધ સમાન હોય છે. સાચો ધર્મ એક જ છે છતાં તેને આચરવાની વિભિન્ન રીતો હોઈ શકે.

ધર્મ અને યોગનો નિષ્ઠા, કપાળ ઉપરના ટીલાં-ટપકાંથી, ગુંથેલી જટા અને લાંબી દાઢી રાખવાથી, સૂર્ય નીચે ગરમીમાં કે ઠંડા પાણીમાં રહેવાથી, ભગવા રંગનાં કપડાં પહેરવાથી, માથું મુંડાવવાથી, ધંટ વગાડવાથી, શંખ ઝૂકવાથી, કરતાલ બજાવવાથી કાઢી શકાય નહિ. વાસ્તવિક યોગ એટલે દુન્યવી આકર્ષણો અને લાલચો વચ્ચે ભલાઈ, પવિત્રતા અને સેવાથી સભર જીવન.

યોગ અને ધર્મમાં આવશ્યક અને બિનઆવશ્યક તત્ત્વાનું તમને સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. તમારે તમારી વિવેકશક્તિ અને પૃથ્વીશક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તમારે તમારા વહેવારિક જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. તો જ તમે આધ્યાત્મિક પથ ઉપર ત્વરિત ગતિ કરી શકશો અને સફળતા પામી ભગવાનનાં ચરણોમાં આવી પહોંચશો.

શુદ્ધ અને નિષ્ઠાંક હૃદયવાળા તમારા પર ઈશ્વરના આશીર્વાદ હો !

આધ્યાત્મિક પથ પર પ્રગતિ માટે અને શાંતિ, પરમસુખ અને શાશ્વત આનંદ પ્રાપ્ત કરવા માટે ઈશ્વર તમને બળ, સામર્થ્ય અને જ્ઞાન આપો.

‘યોગના પાઠ’માંથી સાભાર

## ગુરુદેવનો વારસ - સ્વામી ચિદાનંદ

- શ્રી સ્વામી ચૈતન્યાનંદજી



【આનંદ કુટિરમાં લંગોટીભર આવેલ યુવાન વેક્ટામલ માલીએ પૂ. ગુરુદેવના ૧૮૪૮માં પ્રથમ દર્શન કર્યા. ગુરુદેવ તેમને 'સ્વામી સત્યચિદાનંદજી' નામ આપ્યું. પાછળથી તેઓ અમેરિકામાં સ્થાવી થયા. પૂ. ગુરુદેવના અનન્ય શિષ્ય તરીકે તેમણે જીવનભર વિશ્વશાંતિ તથા સમગ્ર વિશ્વને માટે ઉપદેશો આપ્યા. તેમણે ૨૦૦૩માં મહાસમાપ્તિ લીધી. -સંપાદક】

શ્રીધર રાવજી (પૂ. સ્વામી ચિદાનંદજીનું પૂર્વશ્રીમનું નામ) શિવાનંદ આશ્રમમાં સન ૧૮૪૮માં જોડાયા. તેમણે છ વર્ષ પછી સંન્યાસ ગ્રહણ કર્યો. હું આશ્રમમાં ૧૮૪૭માં જોડાયો.

શ્રીધર રાવ બીજા શિષ્યો કરતાં તેમના કેટલાક જન્મજાત ઉમદા ગુણો અને આગળ પડતી કાર્યશક્તિને લીધે ગુરુદેવને વધુ વહાલા હતા. ફક્ત આશ્રમવાસીઓ જ નહીં પણ ભક્તો અને બીજા મુલાકાતીઓ પણ તેમના કરતાં વધુ સિનિયર ગુરુભાઈઓ કરતાં તેમને વધુ આદર આપતા, પરંતુ કેટલાક તેમને ઓળખી શક્યા ન હતા. કેટલાક એમ માનતા કે તે પોતે ગુરુની માફક વર્તે છે. કેટલાક તેમને ખૂબ કુનેહબાજ અને આંદબરી માનતા. મારો પોતાનો અભિપ્રાય તદ્દન જુદો જ હતો. હું તેમને ઉચ્ચતમ પ્રકારના સાધક, પુરુષોત્તમ માનતો, અમે બધા સામાન્ય પ્રકારના પુરુષો, સાધકો છીએ તેમ અનુભવતો. પૂ. ગુરુદેવ મનુષ્યોની પરખમાં નિષ્ણાત હતા. જ્યારે તેઓ રાવજીને ખૂબ ઊંચી કક્ષાના ગણતા હોય પછી તે માટે બીજાએ કંઈ કહેવાનું હોય નહીં.

રાવજીના સંન્યાસ પહેલાં અને સંન્યાસ પછી ગુરુદેવ રાવજી તેમના વારસ બનશે તેમ જણાયું હતું. જ્યારે બધા ગુરુદેવનાં દર્શન માટે આતુર હોય ત્યારે ગુરુદેવ ચિદાનંદજીના દર્શન માટે આતુર રહેતા. જ્યારે ચિદાનંદજી ગુરુદેવની વિદ્યાય લે ત્યારે 'દર્શન આપતા રહેજો' તેમ કહેતા. આપણે બધા હવે જાણીએ છીએ કે ગુરુદેવની ભવિષ્યવાણી તદ્દન સાચી પડી હતી.

રાવજીનો આહાર સામાન્ય બીજા સાધકોને અપાતો તેનો સામાન્ય ન હતો. તેમને દૂધ, ફળ, બિસ્કિટ વગેરે આપવામાં આવતાં. તેમનું લીવર નબળું હોવાથી તેઓ ખોરાકમાં મસાલેદાર વસ્તુઓ લેવાનું ટાળતા. તેમને બીજા કરતાં વધારે ખાંડ જોઈતી.

ગુરુદેવ તેમની આ બધી જરૂરિયાતો પૂરી થાય તે જોતા અને તેમના સ્વાસ્થ્ય માટે ખાસ ધ્યાન રાખતા. પરિણામે કેટલાક સિનિયર આશ્રમવાસીઓ ઈર્ઝા કરતા અને છૂપો વિરોધ પણ દર્શાવતા. રાવજી ઉચ્ચ ઉમરાવ કુંઠબમાંથી આવતા હોવાથી તેમની કેટલીક ટેવો અને ધોરણો ઊંચા ગર્ભશ્રીમંત કુંઠબ જેવાં હતાં.

રાવજીને શરૂઆતમાં મુશ્કેલીઓ અને અસંતોષ થયાં હશે પણ ટૂંક સમયમાં તેઓ આશ્રમની રહેણીકરણીમાં ગોઠવાઈ ગયા અને ગુરુદેવની આધ્યાત્મિક ઉપલબ્ધિનો પણ પૂરો ખ્યાલ આવી ગયો. તેમણે ગુરુદેવના જીવનને લગતું ખૂબ વખણાયેલું પુસ્તક 'The Light Fountain' 'પ્રકાશનો કુવારો' - 'Prism' પ્રીજીમ નામથી લખ્યું. તે વખતે તેઓ ફક્ત ૨૮ વર્ષના હતા.

રાવજી સંન્યાસ માટે પૂર્ણ લાયકાત ધરાવતા હોવાથી ગુરુદેવ તેમને સંન્યાસ-દીક્ષા આપવા આતુર હતા અને તે માટે તેમને ઘણી વાર કહ્યું પણ હતું. રાવજી માનતા હતા કે બ્રહ્મચારી રૂપે તેઓ બાર વર્ષ રહે અને તેમને ખાતરી થાય કે તેઓ સંન્યાસ બરાબર પાળી શકશે તો જ સંન્યાસ લેવો. એટલે તેઓ દરેક વખતે ગુરુદેવને જવાબ આપતા : 'સ્વામીજી, હજુ હું લાયક થયો નથી.' છ વર્ષ પછી ગુરુદેવ હવે વધુ રાહ જોવા તૈયાર ન હતા. તેમણે રાવજીને કહ્યું : 'તું દર વખતે હજુ હું સંન્યાસને લાયક નથી એમ કહે છે. જો તું સંન્યાસ માટે લાયક ન હોય તો પછી બીજું કોણ લાયક છે? ગુરુપૂર્ણિમા આવે છે, પણ તને આગળથી તારું સંન્યાસ નામ આપી દઉં છું. તું સ્વામી ચિદાનંદ નામથી ઓળખાઈશ.' અને આમ રાવજીના સંન્યાસનું નક્કી થઈ ગયું.

'A Saga of Spiritual Unfoldment'માંથી અનુવાદ

## મનાચે શ્લોક - મનોભોદ્ધ

- શ્રી સ્વામી અધ્યાત્માનંદજી



હરેદ્વારના ભોલેબાબા બહુ મુક્ત મને કહેતા,  
‘ઈસ દેહકો મૈં માનના; સબસે બડા પાપ હૈ ।  
સબ પાપ ઈસકે પુત્ર હૈ; સબ પાપકા યહ બાપ હૈ ॥’

આ સંબંધી વેદોમાં પણ કથા છે કે દેવ, દાનવ  
અને માનવો પ્રજાપતિ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે ગયેલા.  
પ્રજાપતિએ ઉપદેશ આપતાં કહેલું કે, ‘તમો જ બ્રહ્મ  
છો.’ માનવો તો રાજુ થઈ ગયા. દાનવો પણ રાજુ  
થયા. આ રાજસિક અને તામસિક જીવનનાં મૂર્તસ્વરૂપો  
આહાર, નિદ્રા અને મૈથુનમાં જ પ્રવૃત્ત રહ્યા. અમે તો  
બ્રહ્મ જ છીએ. હવે અમો નિત્યમુક્ત નિત્યસત્ય, અમે  
જ શુદ્ધ અને બુદ્ધ. એક બ્રાંતિભર્યું જીવન, પરંતુ ઈન્દ્ર  
વિચારશીલ હતા. ઈન્દ્ર મેધાના ધણી કહેવાય છે. તેમણે  
શાંતિથી ચિંતન કર્યું. ‘હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું. મારે  
તો સીમિત સામ્રાજ્ય છે. મારે પરિવાર છે. કબીલો છે.  
પત્ની, પુત્ર, મોહ, માયા અને અહંકાર તથા લોભ અને  
સ્વાર્થ પણ છે. બ્રહ્મ તો સીમાઓમાં બંધાપેલ નથી, પછી  
હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું ?’

તેઓ ફરીથી પ્રજાપતિ પાસે ગયા. ‘પ્રભો ! હું  
બ્રહ્મ કેવી રીતે હોઈ શકું ?’ પ્રજાપતિએ મૂર્ખ હાસ્ય વેર્યુ.  
કહ્યું, ‘ખરું, તમો નથી, પણ તમો જ છો.’ ઈન્દ્ર પાછા  
આવ્યા.

ફરીથી ચિંતન ચાલ્યું. હું શરીર નથી. તો પછી  
મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર પણ ન જ હોઈ શકું.  
તો પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પણ ન જ હોઈ  
શકું. આ પાંચ તન્માત્રા પાંચ ગ્રાણ, પાંચ કર્મન્દ્રિય કે  
જ્ઞાનેન્દ્રિય પણ ન જ હોઈ શકું. તો શું હું આત્મા છું ?  
તે બ્રહ્મ ! કદાચ હોઈ શકે ? ફરીથી તેઓ એક નવો  
નિર્જર્ખ લઈને આવ્યા અને પ્રજાપતિને બહુ જ વિનયપૂર્વક  
દેહરક્ષણાકારણોં યત્ન કેલા,

પરી શેવટી કાળ ઘેવોને ગેલા ।  
કરીં રે મના ભક્તિ યા રાધવાચી  
પુઢે અંતરી સાર્વિંતા ભવાચી ॥

પૂછજ્યું, ‘શું મારો આત્મા બ્રહ્મ છે ?’

પ્રજાપતિ કંઈ જ ન બોલ્યા. બસ, મૌન જ રહ્યા.  
ઈન્દ્ર ફરીથી આત્મચિંતન કર્યું. વિચાર કર્યો; પ્રજાપતિ  
શા માટે મૌન રહ્યા. શું મૌન જ બ્રહ્મ છે ?

પ્રજાપતિ કંઈ જ ન બોલ્યા. બસ મૌન જ રહ્યા.  
ઈન્દ્ર ફરીથી આત્મચિંતન કર્યું; વિચાર કર્યો; પ્રજાપતિ  
શા માટે મૌન રહ્યા. શું મૌન જ બ્રહ્મ છે ? અને તેમની  
ચેતનામાં અદ્ભુત સળવળાટ થયો. અંદરથી એક નવું  
જ જ્ઞાનકિરણ ઉદ્ભવ્યું. હા ! બ્રહ્મ એટલે શરીર, મન,  
બુદ્ધિ, ચિત્ત, અહંકાર નહીં. બ્રહ્મ તે ઈન્દ્રિયગોચર તત્ત્વ  
નથી. તે શબ્દમાં વર્ણવી શકાય નહીં. ઈન્દ્રિયોથી  
પારખી કે અનુભવી શકાય નહીં.

“યતો વાચો નિવર્તને । અપ્રાય મનસા સહ ।  
આનંદ બ્રહ્મણો વિદ્બાન્ । ન બિભેતિ કદાચનેતિ ।”

બ્રહ્માનુભૂતિ એટલે અહીં વાણી વિલય પામે છે.  
તે અવાંગમનસગોચર છે. તે વાણીથી પર કેવળ  
આનંદ સ્વરૂપ છે. ‘બ્રહ્માનંદ પરમ સુખાં કેવળં  
જ્ઞાનમૂર્તિમ् ।’

આ થયું ઔપનિષદીય સત્ય, છતાં કવિ કાલિદાસ  
તેમના ‘રઘુવંશમ્’માં કહે છે, “ધર્મઅર્થકામમોક્ષાઙ્  
આરોગ્યં મૂલં ઉતામમ્” તે પણ પ્રત્યક્ષ સત્ય જ છે.  
જે બ્રહ્મની ઉપલબ્ધિ કે પ્રાપ્તિ કે અનુભૂતિ કરવાની  
છે, તે શરીર થકી જ થશે. ‘શરીર માધ્યં ખલુ  
ધર્મસાધનમ્’ શરીર તો સાધન છે. તેનું આરોગ્ય  
આવશ્યક છે. તેને અવગાણી શકાય તેમ નથી.

ત્યારે અહીં સંત રામદાસજી ‘મનાચે શ્લોક’માં  
જે કંઈ કહે છે,

તનુ રક્ષવા કારણો યત્ન કીધ્યા,

છતાં છેવટે કાળમુખે ગ્રસાયા;  
કરે ભક્તિ આ મન સીતાપતિની  
પછી છાડ ચિંતા ઉરે સંસુદ્ધિની.

તेनो અર્થ શું ?

શરીરને નકારવાનું નથી, પરંતુ શરીરને જ શાશગાર્ય કરવાનું પણ નથી. આપણે થોડી પળો પણ આંતરમુખ થઈને વિચાર કરશું તો સમજશે કે નહાવા, ધોવા, દાઢી બનાવવાની, વાળ ઓળવાના, પેરીક્યોર, મેનીક્યોર, ફેસિયલ, સોનાબાથ, મસાજ, આયુર્વેદિક હર્બલ ટ્રીટમેન્ટ, ડાયેટિંગ, યોગ, એરોબિક વગેરેમાં શરીરને સુદૃઢ અને સુંદર રાખવા માટે જેટલા અને જે જે દિશામાં પ્રયત્નો કરીએ છીએ તેમાંનો એક ટકો પણ ‘મેન્ટલ હાર્ડ્ઝન’ વિશે આપણે સતર્ક-સમાન છીએ ? શ્રી રામ તો બહુ જ દૂરની વાત છે. રામ તેમના સચ્ચારિત્ય માટે જાણીતા છે. તેમના પિતાશ્રીને ગ્રણ રાણીઓ હતી. શ્રી રામે પરણ્યાની પહેલી રાત્રે સીતાજીને કહેલું, “દેવી ! હું તમોને વિશેષ ભેટ આપવા માગું છું અને તે એ છે કે હું એકપણીક્રત ધારણ કરું છું.” અરણ્યકંડમાં શૂર્પણાખા શ્રી રામને પોતાની સાથે પરણવા વિનવે છે, પરંતુ શ્રી રામ મક્કમ છે. મારે એક પત્ની છે. બીજી ન કરી શકું ! વગેરે. હજુ આ નવરાત્રીના પહેલે જ દિવસે એક જાણીતા સમાચારપત્રે તેમના મેગેજિન વિભાગના પહેલા જ પાને ગરબા રમતા એક સમૂહનો ફોટો છાપ્યો હતો. જેમાં એક બહેન ગરબે રમતાં એટલાં બધાં તો મશાગૂલ થઈ ગયેલાં કે તેમની ઓફલાઈન અને ચણિયો છેક ઘૂંઠણ સુધી આવી ગયાં હતાં. નીચે લખવામાં આવ્યું હતું કે, ‘કોઈની પણ પરવાનગી વગર કોઈના પણ ફોટા પાડવા તે ગુનો છે તો આ ફોટો આવી રીતે પાંચ લાખ કોપીઓમાં છાપવો તે ગુનો નથી ?’ (કદાચ અહીં આ લખવાનું પણ ઉચિત નથી જ.) આ છે આપણા ‘મેન્ટલહાર્ડ્ઝન’નું સ્તર. આપણે દેહ અને ગેહના તાણાવાણા વચ્ચે જ અટવાયેલા છીએ.

શ્રી શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ ખૂબ જ દુઃખ સાથે આ વિષયમાં કહે છે, ‘કલીજુગે લોકેર મોન નાભી લીંગ ગુદા થેકે ઉપરે આસબે ના’ કલિયુગમાં લોકોનાં મન નાભિની નીચે જ રહે છે. તેને યૌગિક ભાષામાં કહી

શકાય કે મન મણિપુરચક્થી ઉપર આવશે નહીં. અનાહત અને સહસ્નાર તો બહુ જ દૂર રહેશે.

શ્રી રામદાસજી કહે છે, આ તનની પળોજણ તો બહુ કરી, પરંતુ અંતે જાતસ્ય હી શ્રુવો મૃત્યુ : જેનો જન્મ છે, તેને મૃત્યુ અનિવાર્ય છે. જે ઘડો ઘડાયો તે ફૂટવાનો ચોક્કસ. આપણે જન્મ મળ્યો છે, મૃત્યુ અનિવાર્ય છે, ચોક્કસ છે, પરંતુ આ બંને વચ્ચેના અંતરને જીવન કહી શકાય નહીં. જીવન તો શોધવું પડશે. સંગીતના સાધનને સંગીત કહી શકાય નહીં. તેમાં સંગીત ઉપજાવવું પડે. ખડજ રીખભ ગંધાર વૈવત, કોઈ વાદીસંવાદી, આરોહઅવરોહી થાય ત્યારે સંગીત સર્જય. આ દેહમાં એક તત્ત્વ ઈશ્વરે આપ્યું છે, તેનું નામ છે વિવેક. આપણો ધીરજ અને વિવેકની બે પાંખો વડે પ્રભુપ્રેમ, પ્રભુસ્મરણના આકાશમાં ઊરી શકીએ છીએ.

શ્રી રામદાસ કહે છે, આ મનને સીતાપતિની ભક્તિમાં જોડ. બસ ! બેડો પાર. પછી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના ચકની ચિંતા શ્રીરામ સાંભળશે જ.

શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે-

સર્વધર્માન્પારિત્યજ્ય મામેકં શરણં રાજ ।  
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥

(ગીતા : ૧૮ : ૬૬)

શ્રી કૃષ્ણો તો તેથીયે વધુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે,  
મનમાં ભવ મદ્ભક્તાનો મધ્યાળ માં નમસ્કિરુ ।  
મામેવેષ્યસિ સત્યં તે પ્રતિજ્ઞાને પ્રિયોક્ષસિ મે ॥

(ગીતા : ૧૮ : ૬૫)

હું તને સત્ય વચ્ચન આપું છું, કારણ કે તું મને પ્રિય છે. મારામાં પરાયણ થા, મારો ભક્ત થા, મારે અર્થે યજ્ઞ કર, મને નમસ્કાર કર.

આ બધાંનો સાર પુનિત મહારાજના શબ્દોમાં ‘એક ડગ ભરતાં દસ ડગ આવે શામળિયો સરકાર’ પ્રભુપ્રીતિમાં મન રાખો. બાકી બધી ઈશ્વરને ખબર જ છે. ઊં શાંતિ.

## શાંતિનો વ્યવહારુ અભિગમ

શ્રી યોગેશ્વર



જીવનમાં અશાંતિ છે. અનેક આત્માઓ અશાંતિ અનુભવે છે. કિન્તુ એનું કારણ એક છે ? શાંતિની હઠાથી આવનારા સૌ કોઈને આપણે એવું કહીએ કે પરમાત્માની પ્રાપ્તિ કરો. પરમાત્માને પ્રેમ કરો અને ઓળખો. જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નહિ કરો ત્યાં સુધી શાંતિ નહિ મળે. ના, એ પ્રકારનો સર્વસામાન્ય અને અભ્યવહારુ અથવા ઉડાઉ ઉત્તર આપવાનું ઉચિત નહીં લેખાય. પરમાત્માની પ્રાપ્તિ કરવાથી કે કરવાનો પ્રામાણિક, એકનિષ્ઠ, શ્રદ્ધા-ભક્તિપૂર્વકનો પુરુષાર્થ કરવાથી, ગમે તેવા સંજોગોમાં પણ, અનુકૂળ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનને સ્વસ્થ, સંયમી, સાચ્ચિક, શાંત રાખવાની શક્તિ સાંપડશે. સમત્વથી સંપત્ત બનાશે. પરંતુ સદાને સારુ સર્વવિધ શાંતિ સાંપડશે એવું માનવું, મનાવવું વધારે પડતું છે. જીવનમાં અશાંતિ છે એ સાચું છે. તેમ એ પણ એટલું જ સાચું છે કે એ અશાંતિનાં કારણો જુદાં જુદાં છે. પ્રત્યેક વ્યક્તિની સમસ્યાઓ જુદી જુદી હોય છે. શાંતિને માટેની આવશ્યકતાઓ પણ અલગ હોય છે. એ સમસ્યાઓમાં ભૌતિક, શારીરિક, માનસિક, સાંસારિક, આત્મિક સમસ્યાઓનો સમાવેશ પણ થઈ જાય છે. અશાંતિ જેને લીધે પેદા થઈ હોય કે બનતી હોય, એ સમસ્યાને અવગાણવાને બદલે શાંતિપૂર્વક વિચારવાથી અશાંતિ મટી શકે છે. એ સીધાસાઢા સત્યને જેટલી વહેલી તકે સમજ લઈએ એટલું જ હિતાવહ થઈ પડશે. સંક્ષેપમાં કહીએ તો કહી શકાય કે ભૌતિક, આપણી આગળની અનેકવિધ સમસ્યાઓની સહાનુભૂતિપૂર્વકની વિચારણા અને એમના ઉકેલ માટેના પ્રયત્નો આવશ્યક, આવકારદાયક, અભિનંદનીય છે.

પરમાત્માને ઓળખવાની અભિલાષા જેને તેને નથી હોતી. પરમાત્માને પામવાની પિપાસા

કોઈકના જ જીવનમાં પેદા થાય છે. એવા આત્માને પરમાત્માને માર્ગે વળવા દો. પરમાત્માના પંથે સાધનાત્મક પ્રયાણ કરવા દો. એના સિવાય એને શાંતિ નહીં મળે. બાકી આપણી આજુબાજુના અધિકાંશ અશાંત આત્માઓની શાંતિ માટે તો એમની અશાંતિના કારણને શોધી કાઢીને કે સમજ જઈને વ્યવહારુ અભિગમ અપનાવાય એ જ બરાબર છે. આપણે વ્યવહારુ બનીએ તો કેટલીય મુસીબતોમાંથી સહેલાઈથી મુક્તિ મેળવીએ.

### તરણા ઓથે કુંગર રે

- ભક્ત ધીરો

તરણા ઓથે કુંગર રે, કુંગર કોઈ દેખે નહિ; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી. સિંહ અજામાં કરે ગર્જના, કસ્તૂરી મૃગરાજન, તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાણમાં હુતાશન; દધિ ઓથે ધૂત જ રે, વસ્તુ એમ ધૂપી રહી. કોને કહું ને કોણ સાંભળશે ? અગમ ખેલ અપાર, અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર; એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહીં. મનપવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ; ઠામ નહિ કો ઠાલો રે, એક અશુમાત્ર કહી; સદ્ગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા રે પ્રકાશ; શાં શાં દોડી સાધન સાધે ? પોતે પોતાની પાસ; દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુંહિ તુંહિ.

‘બૃહ્દ ગુજરાતી કાવ્યસમુદ્રિ’માંથી સાભાર

## ‘યોગ એ જ જીવન’ (૩)

શ્રી સ્વામી અધ્યાત્માનંદજી



### શિદ્ધાંતની વૃત્તિઓનું શમન એટલે યોગમય જીવન

[ન્યૂયોર્ક (અમેરિકા)થી ‘ગુજરાત ટાઈમ્સ’ નામનું સાપ્તાહિક પ્રગટ થાય છે તેના મેગેજિન વિભાગ સપ્તકમાં પૂ.સ્વામીજી વિભિન્ન ‘યોગ એ જ જીવન’ની લેખ શ્રીંખલી પ્રગટ થાય છે. તેમાંથી નીચેનો લેખ આપણે ‘દિવ્ય જીવન’માં સામાર લઈએ લીધે. -સંપાદક]

યોગનો અર્થ જ સંતુલન છે, સમત્વ છે. યોગનો અર્થ કર્મમાં કૌશલ-કુશળતા હોવી તે પણ છે, અને અંતે ચિન્તની વૃત્તિઓનું શમન, શાશ્વત ચિરંતન શાંતિપૂર્વકનું જીવન એટલે જ યોગમય જીવન છે.

શિક્ષકોને માટે બીજી જે સાવધાની શિક્ષણ આપતાં વરતવાની તે એ કે (૧) તેમણે જે કંઈ ભણાવવાનું છે તે બધું તેઓ જાતે સારી રીતે આત્મસાત્કરે. જ્ઞાણો, ભાષે, સમજે, પચાવે પછી સમજાવે. એક જ વિષય ૨૦ વર્ષથી ભણાવતાં હોઈએ તો પણ તે વિષયસંબંધી જગતભરમાં જે ચિન્તન-મનન થઈ રહ્યું છે, તેનો સંબંધ-વાચન-વિચાર દ્વારા શિક્ષકોએ રાખવો જ જોઈએ. (૨) દરરોજનો પાઠ ભણાવતાં પૂર્વે એક વખત સારી રીતે ફરીથી વર્ગમાં જતાં પૂર્વે - કે - ઘરે જોઈ જવો ખૂબ જ જરૂરી છે. (૩) જે વિષય ભણાવવાનો છે, તેની સાથે સુસંગત કરતા હોય તેવા વિષયોના વાચનનો મહાવરો પણ ખૂબ જ આવશ્યક છે. આજકાલ કોમ્પ્યુટરમાં ડગલાબંધ માહિતી મળતી હોય છે. તેથી કોમ્પ્યુટર દ્વારા પણ શિક્ષકોએ શિક્ષા અને શિક્ષાર્થીઓનું લક્ષ્ય જાગ્રત રાખવું જોઈએ. (૪) આપણે ગમે તેટલા વિદ્વાન હોઈએ, પણ વિદ્યાર્થીઓને કદીય મૂક ન જાણવા જોઈએ. અનેક વિદ્યાર્થીઓ અનેક વિષયોમાં ખૂબ જ પારંગત હોય છે, માટે કયારેય પણ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો જો તે વિષયસંબંધી જ્ઞાન હોય તો જ સચોટ અને યોગ્ય જવાબ આપવો, પરંતુ જો જવાબ ખબર ન હોય તો મને ખબર નથી, આવતી કાલે રિફર કરીને કહીશ તેવું કહેવાનું વધારે યોગ્ય છે. ગપ્પું મારવું નહિ, કારણ કે એક વખત વિદ્યાર્થીઓની શ્રદ્ધા તમારામાંથી

ઉઠી જશે તો પછી તે શ્રદ્ધા કાયમી કરવાનું બહુ જ દુષ્કર થશે. સાચું કહેવામાં તમારી પ્રતિજ્ઞા વધશે, માટે ઉડાઉ જવાબ તો કદીય આપવો નહિ. (૫) વિદ્યાર્થીઓ સમજ શકે તેવા સ્તર પર આવીને તેમને સમજાય તેવી ભાષામાં પાઠ ભણાવવો. વિષયને સરળ બનાવીને શીખવવો. પોતાના જ્ઞાનનો પ્રભાવ દેખાડવા કદીય કોમ્પ્લિકેટેડ કરીને વિષય શીખવવો નહિ. (૬) અને અંતે ભણાવવામાં રુચિ રાખવી. જો ભણાવવામાં રુચિ જ નહિ હોય તો તમે મજૂરી કરો છો અને વિદ્યાર્થીઓને ભણતરમાં કદીય રસ પડે - માટે ખૂબ જ રસપૂર્વક ભણાવવું જોઈએ.

હવે થોડી વાત વિદ્યાર્થીઓ માટે પણ સમજવી જોઈએ. ભણવા માટે - સારી રીતે વિષયને સમજવા માટેનું એક સૂત્ર છે. I.R.A. | એટલે ઈમ્પ્રેશન, R એટલે રિપિટેશન અને A એટલે એસોસિયેશન. (૧) ઈમ્પ્રેશન, (૨) રિપિટેશન અને (૩) એસોસિયેશન. (૧) વર્ગમાં આવતાં પૂર્વે આજે શું ભણવાનું છે, તે પુસ્તકોમાં જોઈ લઈએ, ગઈ કાલના લેસનને પણ રિફર કરી લઈએ તો જે ઈમ્પ્રેશન તૈયાર થશે, તે જ (૨) વર્ગમાં શિક્ષક ભણાવે તે રિપિટેશન થશે અને (૩) ઘરે જઈને હોમવર્ક કરી લઈએ એટલે એસોસિયેશન થશે. એક દિવસમાં ગ્રાન્ટ આવર્તન થયાં એટલે પાઠ પાકો.

ભણતી વખતે મનમાં ભણતરનો જ વિચાર હોય તો ભણતર ચઢે. વરસાદ પડે ત્યારે ગાડીના કાચને વાઈપરથી સાફ કર્યા કરવો પડે છે. ભણતરના સમયે અનેક પ્રકારનાં કુંડાળાં મન કર્યા જ કરતું હોય છે. શરીર તો ચોપડી લઈને બેસે. આંખો પણ ખુલ્લી

જ હોય. શરીર સ્થિર જ હોય. ચોપડી છેક મો પાસે હોય, પરંતુ આંખો સામે બધું જ ધોળાયેલું ધપ્પ ! એક લાઈન વંચાતી નથી, કારણ કે એકેય લાઈન દેખાતી જ નથી. બે કલાક સુધી બેઠાં, પરંતુ પાઠમાં ભીંહું. આવું થતું હોય છે. કારણ શરીર સોલ્ટલેઇટમાં ઉટાણ અને મન માન્યેસ્ટર લંડનમાં, આ શરીર જ્યાં હોય અને મન પણ ત્યાં હોય તો યોગ, નહિ તો વિયોગ. સોયના કાણામાં દોરો પરોવવાનો છે. દોરો અનેક ફાઈબરથી બને છે, પરંતુ જો એક પણ ફાઈબર ડાબે જમણે ગયો તો તે દોરાને સોયના કાણામાં પરોવી શકાય નહિ. તે બધાં જ ફાઈબરને એક તરફ એકમુખી - એકાગ્ર કરવાં પડે, તો તરત જ દોરો સોયના કાણામાં પ્રવેશ કરે.

તેવું જ મનનું છે. મનને સંપૂર્ણપણે એક જ દિશામાં એક સ્થાને સ્થિર કરવું પડે. શિક્ષકની ભણાવવામાં રુચિ છે. શિક્ષક બાહોશ પણ છે, પરંતુ વિદ્યાર્થીની જ ભણવામાં રુચિ ન હોય તો તેને માટે કવિ કહે છે, ‘અરસિકેષુ મા લિખ, મા લિખ મા લિખ’ જેને રસ ન હોય તેને ભણાવવાનું હે વિધાતા ! મારા ભાગ્યમાં ન લખ, ન લખ, ન લખ.

પ્રાણાયામનો અભ્યાસ મનની ચંચળતાનું શમન કરે છે. પ્રાણાયામ મનની અશ્વીલતાનું પણ નિવારણ કરે છે. પ્રાણાયામનો અભ્યાસ મનની વિચારક્ષમતા, સહનશીલતા, મેધાશક્તિ અને તર્કશક્તિના વિકાસની સાથે મનને સદા પ્રફુલ્લિત રાખે છે. ઊંકાર અને ભમરી વિશે આપણે જાણ્યું છે. આપણે પ્રાર્થના કરી, તેનો અર્થ પણ સમજ્યા. આ પ્રાર્થના એટલે સદ્વિચારોનો સમૂહ કે વૈશ્વિક ક્ષમતા સાથે ઐક્ય.

પ્રાર્થના એટલે કંઈ માગવાનું નથી. પ્રાર્થના તો આપણી અને પ્રભુ સાથે જોડતો સેતુ છે. પ્રાર્થના એટલે હૃદયની વાત પ્રભુને કહેવી તે. પ્રાર્થના એટલે હૃદયની ઊર્મિઓની અભિવ્યક્તિ. અમો ‘સહ નાવવતુ’ પછી બીજી એક પ્રાર્થના અચૂક બોલીએ છીએ. ‘ભૂમિ મંગલમું, ઉદ્ક મંગલમું, ગગન મંગલમું, સૂર્ય મંગલમું,

ચંદ્ર મંગલમું, વાયુ મંગલમું, અજિ મંગલમું, જીવ મંગલમું, જગત મંગલમું, મનો મંગલમું, આત્મ મંગલમું, સર્વ મંગલમું, સર્વ મંગલમું ભવતુ ભવતુ ભવતુ । અહીં પ્રકૃતિ સાથેનું ઐક્ય અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય ઇચ્છેલું છે. પૃથ્વી, જળ, ગગન, સૂર્ય, ચંદ્ર, વાયુ, અજિ, જીવ, જગત, મન અને આત્મા સૌનું મંગલ થાઓ. સૌ મંગલ કરો.’

યોગનો અર્થ શીર્ષસિન કે સર્વાગાસન તો કદીય નથી. યોગનો અર્થ વ્યક્તિનું સમાચિમાં ઐક્ય. આ પૂષા મારૂત મેઘ સૌ ઉભયને કુર્યાત્ સદા મંગલમુંની શુભાકંક્ષા છે. શુભેચ્છા છે. આપણે અહીં આપણા અમેરિકામાં ફાર્સર્સ તે, મધર્સ તે, વેલેન્ટિના કે વેલેન્ટાઈન તે કરીએ છીએ, ત્યાં નેચર્સ તે કર્યાં ! તેના વગર તો આપણું કંઈ ચાલે તેમ નથી. આખી એક ચેનલ ચોવીસ કલાક વેધર્સ ન્યૂસ આપ્યા કરે છે. આપણે આગલી સાંજે કે હવે તો સન્દે - સન્દેના રોજ નેક્સ્ટ વીક - આગલા અઠવાડિયાનો કાર્યક્રમ ઘડવા માટે વેધર્સ જોઈ લઈએ છીએ. આ સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્ર આપણા જીવનના અવિભાજ્ય અંગો છે. તેમને નકારી શકાય તેમ નથી. અમેરિકાની જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વની સૌથી મોટી ઉપલબ્ધ આ આકાશી ખગોળ-વિજ્ઞાન સાથેનું ઐક્ય છે, માટે જ પ્રાર્થનામાં આવી રીતે સૌના મંગલની કામના કરી છે. એક વૈદિક પ્રાર્થના છે. તેનું પણ ભાખાંતર કરીને બોલીએ છીએ. ‘સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ન હો દુઃખી, સૌનું થાઓ મંગલ, પૂરબ મેં પણ્ણી મેં, ઉત્તર મેં, દક્ષિણ મેં, પછાડો મેં, સમુદ્ર મેં, બન મેં, જંગલ મેં, જન જન તે જીવનમેં. શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.’ આ વૈદિક ઋષિઓને પોતાના સ્વાર્થ જેવું કશુંય નહોતું. તેઓની કામના તો સર્વેષાં સ્વતિ ભવતુ - સૌનું હો કલ્યાણમાં જ સમાહિત હતી. આ જ સાચો યોગ છે. જર્મનીના સુપ્રાસિદ્ધ તત્ત્વચિંતક કહે છે, You can not pluck flower in your own garden without disturbing the star in the heaven. તમે તમારા બગીચામાંનું ફૂલ આકાશના તારાઓને દખલ કર્યા વગર તોડી શકો નહિ.

આપણે એકલા નથી. આપણા જન્મ પૂર્વે સૃષ્ટિ હતી. જન્મ પછી પણ રહેશે. જન્મ માટે માતા-પિતા સિવાય પ્રસૂતિ કરાવનાર ડોક્ટર, તેનું દવાખાનું, લેબર રૂમ, કોમ્પ્લિકેશન થાય તો ઓપરેશન થિયેટર, એનેસ્થેટિક્સ અને તેમના સહાયકો, ઓક્સિજન, જરૂર હોય તો બ્લડની બોટલ, આમ આટલી તૈયારી હોય છે. જન્મ પછી જે નાળ મોળે છે, (માતા સાથેનું કનેક્ટિગ લિન્ક) તેને માટે છરી-ચાકુનું હથિયાર જોઈએ. તે ક્યાંથી આવ્યું ? તે મેડિકલ સ્ટોરમાં તેની ફેક્ટરીમાંથી આવ્યું. ફેક્ટરીમાં રોમટીરિયલ ખાણમાંથી આવે છે. અમેરિકા તો બહું આચાત જ કરે છે, એટલે ચીન, કોરિયા કે તાઈવાનથી આવ્યું. એક નાળ મોળના માટે આટલી વ્યવસ્થા. બહુ લાંબો હિસાબ માંડવાની આવશ્યકતા નથી. યુદ્ધનો અર્થ જ Harmony છે. વિશ્વથી આપણે આપણી જાતને વિખૂટા પાડી શકીએ નહિ. વિશ્વ સાથેનું ઐક્ય આપણને વિશ્વના બહુભલીય પ્રવાહો આપણા પ્રતિ વહેતા કરશે. આપણે સંબંધવિચ્છેદ કરી નાખીએ તો શક્તિ અને સામર્થ્ય બંનેથી જઈશું, માટે જ પ્રાર્થનાની આવશ્યકતા છે. It's an inner motive as well inner feelings.

અમારા ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજની વિશ્વપ્રાર્થના બહુ જ પ્રય્યાત છે. ઉજ મે, ૧૯૭૯ના રોજ અવિભાજિત U.S.S.R. Mascoના ઉઘુટી પ્રાઈમ મિનિસ્ટર શિવાનંદ આશ્રમ, હષીકેશ ખાતે આવેલા. મુલાકાત તો ૨૦ મિનિટ માટેની હતી. ખાસ્સા અઠી કલાક બેસીને ગયેલા. અમે યોગાસન દેખાડ્યાં હતાં. અમારા ગુરુદેવ શ્રી સ્વામી ચિદાનંદજી મહારાજે કાર્યક્રમના અંતે વિશ્વપ્રાર્થના બોલી હતી. તેની એક એક લાઈનનો તરજુમો-અનુવાદ તે ઉઘુટી પ્રાઈમ મિનિસ્ટર મિસ્ટર આઈ.વી. અરખીપોવને સમજાવવામાં આવ્યો હતો. પ્રાર્થના પૂરી થતાં તેઓ પૂજ્ય સ્વામીજી મહારાજને ભેટી પડેલા, આંખમાં અશ્વુ સાથે રડી પડેલા, સેન્ટિમેન્ટનો કંઈ અંત નહિ. પૂજ્ય મોટા સ્વામીજીએ ગેરૂરંગનું ઊંકાર છાપેલું ટી-શર્ટ બનિયન પહેર્યું હતું,

તે પણ માર્યું. આ પ્રાર્થના છે.

'ઓ સ્નેહ અને કરુણામૂર્તિ પૂજ્ય પ્રભુ !

તને નમસ્કાર હો ! નમસ્કાર હો !

તું સચ્ચિદાનંદધન છે.

તું સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે.

તું સર્વાન્તર્યામી છે.

અમને ઉદારતા, સમદર્શિતા અને સમતા આપ.

શ્રદ્ધા ભક્તિ અને ઉદાપદ આપ.

અમને આધ્યાત્મિક અંતઃશક્તિ આપ કે જેથી

અમે વાસનાઓનું દમન કરી મનોવિજેતા બનીએ.

અમને અહંકાર, કામ, કોષ,

લોભ અને દ્વેષથી મુક્ત કર.

અમારાં હદ્ય દિવ્ય ગુણોથી ભરી હે.

બધાં જ નામરૂપોમાં તારું જ દર્શન કરીએ.

બધાં જ નામરૂપોમાં તારી જ સેવા કરીએ.

હંમેશાં તારું જ રટણ કરીએ, તારું જ સ્મરણ રહે, તારો જ મહિમા ગાઈએ.

કેવળ તારું જ પાપનાશક નામ અમારા હોઠ પર રહે.

અમે તુંમાં જ સ્થિર થઈએ.

હારિઃ ઓમ્ તત્ત્સત'

- સ્વામી શિવાનંદ

આ પ્રાર્થનાને શાંત ચિત્ત બે-ચાર-પાંચ વાર વાંચજો, વિચારજો, વાગ્દોણજો, અંતર પુલકિત થશે. ઈશ્વરનું આપેલું અમેરિકામાં ખૂબ જ સમૃદ્ધ છે, પરંતુ આત્મા ક્યાં ? આપણે સોમથી શુક ભાગદોડમાં જ હીએ. weekendના દિવસે લોન્ડ્રી, વેક્યુમ અને મોલમાં ખરીદી કે પારિવારિક અથવા સામાજિક કાર્યો; કારણ કે આપણાં તો હોળી, દિવાળી, લગ્ન, જન્મ, મરણ બહુ જ weekendમાં જ સેલિંગ્સ થાય. ત્યાં આંતરચેતનાને શોધવી પડે છે. મન સંકુચિત અને શંકાશીલ થયેલાં છે. ઉદારતા અને સરળતા ક્યાં અટવાઈ ગઈ છે તે ખબર નહિ, ત્યારે સ્વામી શિવાનંદકૃત આ વિશ્વપ્રાર્થના નૂતન પથ પ્રદર્શિત કરે છે. (કમશા:)

## અકાગ્રતા અને દ્વાન

શ્રી સ્વામી નિખિલેશ્વરાનંદજી



### દ્વાન આપે છે આધાતોમાં સ્વર્થ રહેવાની શક્તિ

જીવનભરની કમાણી જે બેંકમાં મૂકી હતી અને તેના વ્યાજમાંથી પાછલી જિંદગી સારી રીતે જીવી શકાશે એવી આશા, માધુપુરા બેંક તૂટી પડતાં ભાંગી પડી અને એ આધાત જરવી ન શકતી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. એ જ રીતે શેરબજારમાં રોકેલાં નાણાં ડૂબી જતાં પણ આત્મહત્યા કર્યાનાં ઘણાં ઉદાહરણો જોવા મળે છે. એકના એક પુત્રના મૃત્યુનો આધાત ન જરવાતાં પાગલ થઈ ગયાનાં ઉદાહરણો પણ મળે છે. જીવનની આવી વિષમ સ્થિતિઓમાં એ જ મનુષ્યો સ્વર્થતાપૂર્વક ટકી શકે છે અને મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કરી શકે છે, જેઓ પોતાના રોજિદા જીવનમાં નિયમિત ધ્યાનનો અભ્યાસ કરતાં હોય, કેમ કે ધ્યાનથી તેમની આંતર્ચેતના જાગૃત રહે છે, વિવેકશક્તિ જાગૃત થાય છે. ઉંડી સમજ આવે છે, બાધ્ય ઘટનાઓને મૂલવવાની એક દણ્ણિ આવે છે અને એટલે જ જે સંજોગોમાં સામાન્ય મનુષ્યો નાસી છૂટવાનો કે આત્મહત્યાનો માર્ગ લે છે એ સંજોગોમાં ધ્યાનનો નિયમિત અભ્યાસ કરનાર મનુષ્ય સહેલાઈથી આધાત પચાવી જાય છે અને મુશ્કેલીઓ પાર કરી જાય છે. સ્વામી વિવેકાનંદની શિષ્યા માદામ કાલ્યેનું જીવન આ અંગે પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડે છે.

ફાન્સમાં માદામ કાલ્યે સુવિષ્યાત ગાયિકા હતાં. તે સમયે તેઓ શિકાગોના ઓપેરા થિયેટરમાં સંગીતનો કાર્યક્રમ આપી રહ્યાં હતાં. લોકોએ તાળીઓના ગડગડાટથી એમના સંગીતને વધાવી લીધું, પણ કોણ જાણો કેમ તેમને હદ્યમાં બેચેની થવા લાગી. હતાશાનો ભાવ તેઓ અનુભવવા લાગ્યાં અને તેમને મનમાં થતું હતું કે કાર્યક્રમ ટૂંકાવીને જતાં રહે, પણ લોકોના દબાણથી તેમણે બધા કાર્યક્રમો પૂરા કર્યા અને એ એમનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ રહ્યો, પછી લોકોની પ્રશંસા સાંભળવાની પરવા કર્યા વગર તેઓ ખૂબ જરૂરથી ત્રીન રૂમમાં ચાલ્યાં ગયાં અને ત્યાં ખૂબ દુઃખ અને આધાતજનક સમાચાર

એમની રાહ જોઈ રહ્યા હતા. એ સમાચાર હતા એમની એકની એક દીકરી, એમના જીવનનો એકમાત્ર સહારો, જે સમય તેઓ પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ આપી રહ્યાં હતાં ત્યારે બળીને મૃત્યુ પામી હતી.

તેમના માટે આ આધાત અસહ્ય હતો. પુત્રીનો વિયોગ તેઓ સહી શકે તેમ નહોતાં એટલે તેઓ પણ આત્મહત્યા દ્વારા પોતાનું જીવન ટૂંકાવી નાખવા વિચારી રહ્યાં હતાં. તેમની સાહેલીએ તેમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેઓ કોઈ પણ રીતે આધાતમાંથી બહાર નીકળી શક્યાં નહીં ત્યારે તેમની સાહેલીએ તેમને કહું કે અહીં હિંદના યોગી સ્વામી વિવેકાનંદજી આવ્યા છે. તું એક વાર તેમને મળ. તને સાચી શાંતિ મળશે, પણ તેઓ એમ કરવા માટે પણ તૈયાર થયાં નહીં અને આત્મહત્યા કરવા માટે તળાવમાં પડવા માટે ગયાં, પણ આશ્રયની વાત એ કે તેમણે ચાર ચાર વાર જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો પણ ચારેય વખત તેમણે પોતાના મનની અધ્યયેતન અવસ્થામાં સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાને જવાના રસ્તે પોતાને ઊભેલાં જોયાં એટલે દરેક વખતે તે પોતાના ઘરે પાછાં ફરતાં હતાં. ઈચ્છવા છતાં પણ આત્મહત્યા કરી શક્યાં નહીં અને પાંચમી વખત તો તેઓ જાતે જ અજ્ઞાત રીતે સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાને પહોંચ્યો ગયા. નોકરે દરવાજો ખોલ્યો, તેઓ અંદર ગયાં અને ત્યાં દીવાનખાનામાં એક ખુરશી ઉપર બેસી પડ્યાં. થોડી જ વારમાં પાસેના ઓરડામાંથી ધીર-ગંભીર મધુર અવાજ સંભળાયો : ‘દીકરી, ગભરાઈશ નહીં, અંદર આવ’ અને તેઓ યંત્રવત્ત સ્વામી વિવેકાનંદના અભ્યાસખંડમાં પ્રવેશ્યાં. તેમણે સ્વામીજીને ખુરશી ઉપર બેઠેલા જોયા. ત્યાં તો સ્વામીજી ફરી બોલ્યા, ‘દીકરી, શાંત થા.’ સ્વામીજીની પ્રશાંત મુખમુદ્રા અને મધુર શબ્દોએ એમના ઉપર જાદુઈ અસર કરી. આટઆટલા દિવસોથી મનમાં રહેલાં ભય, હતાશા, અશાંતિ જાણે ક્યાંય ચાલ્યાં ગયાં અને એમને થયું કે જીવન જીવવા

જેવું છે. સ્વામીજીની ધ્યાનાવસ્થાના પ્રભાવે એમનું ચિત્ત શાંત થઈ ગયું અને પદ્ધી તો તેઓ પણ ધ્યાન કરવા લાગ્યાં અને ધ્યાન દ્વારા તેમણે જીવન જીવવાની શક્તિ પ્રાપ્ત કરી લીધી. આ રીતે ધ્યાન જીવનથી હારી ગયેલા, થકી ગયેલા, નિરાશ થયેલા એવા મનુષ્યોને નવું જીવન બસે છે અને એમની આંતરશક્તિઓ પ્રગટ કરે છે. એટલું જ નહીં પણ ધ્યાન દ્વારા તેમને જીવનનો સાચો રાહ પણ મળે છે.

### **ધ્યાનથી સર્જકતા પ્રગટ થાય છે**

સાવ સામાન્ય મનુષ્ય પણ જો નિયમિત ધ્યાન કરે તો તે પોતાના અંતરના ઊંડાણમાં રહેલી દિવ્યતાના સંપર્કમાં આવે છે અને આ દિવ્યતા જાગૃત થતાં તેને દિવ્યશક્તિઓ પ્રાપ્ત થાય છે. અનેક વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના જે મહાન સિદ્ધાંતો શોધ્યા તે તેઓએ ધ્યાનાવસ્થામાં જ શોધ્યા હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને જેના માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો તે ગીતાંજલીનાં ગીતો પણ ધ્યાનાવસ્થામાંથી જ પ્રગટ થયાં હતાં. ભારત માતાનું મહાન ચિત્ર જેમણે દ્યોર્યું તે અવનીન્દ્રનાથ ટાગોરને ભગિની નિવેદિતાએ કહ્યું હતું કે ‘ચિત્ર દોરતાં પહેલાં ધ્યાન કરો’ અને એ ધ્યાનાવસ્થામાં એમને સુંદર દશ્યો દેખાતાં. આ રીતે વૈજ્ઞાનિકો, કલાકારો, સાહિત્યકારો અને સાધકો બધાંને ઊંડા ધ્યાનમાંથી મહાન સર્જનની પ્રેરણા પ્રાપ્ત થાય છે.

### **ધ્યાનથી જીવનમાં પરિવર્તન**

ધ્યાન સામાન્ય મનુષ્યને તો મહાન બનાવે છે, પણ ધ્યાન ગુંડાઓ, ડાકુઓ, લૂંટારાઓ વગેરેમાં પણ મહાન પરિવર્તન લાવે છે, અને એટલા માટે જ તો હવે જેલમાં કેદીઓ માટે પણ ધ્યાનના-વિપશ્યતાના વર્ગો શરૂ કરવામાં આવે છે અને એનાથી કેદીઓની વૃત્તિમાં ઘણું ઘણું પરિવર્તન નોંધાયેલું જોવા મળે છે. તેમની હિંસક અને લડાયક વૃત્તિઓ ધ્યાનથી શાંત બની જાય છે. આપણે પેલા લૂંટારાની સુપ્રસિદ્ધ કથા તો જાણીએ જ છીએ. જંગલમાંથી પસાર થઈ રહેલા નારદમુનિએ એ લૂંટારાને સમજાયું કે લૂંટ કરવી એ પાપ છે, પણ લૂંટારો માનતો હતો કે તે તેનાં માતાપિતા, પત્ની, પુત્ર - બધાં માટે લૂંટ કરે છે એટલે એ પાપના ભાગીદાર સહુ કોઈ બને છે. નારદજીએ તેના

પરિવારજનોને પૂછી આવવા જણાવ્યું. એ પ્રમાણે તે નારદજીને વૃક્ષના થડ સાથે બાંધીને પોતાના ઘરે પૂછવા ગયો. બધાંને પૂછ્યું. સહુએ જવાબ આપ્યો : ‘એ પાપ તું કરે છે, એમાં અમે ભાગીદાર ન બનીએ.’ લૂંટારાની આંખ ખૂલી ગઈ. નારદજી પાસે આવીને તેમના પગમાં પડી તીવ્ર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. નારદજીએ તેને ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું. મંત્ર આપ્યો. એ લૂંટારો રાત-દિવસ ભગવાનના ધ્યાનમાં મગ્ન બની ગયો. એટલા ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયો કે તેના શરીરની આજુબાજુ ઉદ્યર્થના રાફડા લાગી ગયા. તેને આજુબાજુનું કંઈ ભાન ન રહ્યું. વરસો સુધી આ રીતે તપશ્ચર્યા કર્યા બાદ આકાશવાણી તેણે સાંભળી, ‘હે ઋષિ, જાગો, હવે તમે લૂંટારા નથી રહ્યા. ઉધર્થના રાફડા એટલે કે વાલ્ભીકિમાંથી તમારો જન્મ થયો છે, એટલે તમે હવે ઋષિ વાલ્ભીકિ ગણાશો.’ આપણે જાણીએ છીએ કે ઋષિ વાલ્ભીકી કેટલા મહાન હતા. તેમણે રામાયણની રચના કરી. લૂંટારાને પણ ઋષિમાં પરિવર્તન કરવાની પ્રબળ શક્તિ ધ્યાનમાં રહેલી છે.

ધ્યાનથી મન હકારાત્મક બને છે. તેની બધી નકારાત્મક વૃત્તિઓ ધ્યાનના પ્રભાવથી ખરી પડે છે અને મન શુદ્ધ થતાં માનસિક સ્વાસ્થ્ય પણ ઉત્તમ બને છે. ધ્યાન દ્વારા જ મનુષ્ય પોતાની પ્રકૃતિ ઉપર વિજય મેળવી શકે છે, જેણે પોતાના બેકાબૂ મન અને બંડખોર પ્રકૃતિ પર વિજય મેળવી લીધો છે, તે વિશ્વવિજ્યી સમાચાર કરતાં પણ મોટો સમાચાર ગણાય.

### **આધ્યાત્મિક સાધના માટે તો**

#### **ધ્યાન અનિવાર્ય છે**

આધ્યાત્મિક જીવન એટલે અધિ + આત્મિક એટલે આત્મા તરફની ગતિ જેમાં થઈ રહી છે, એવું જીવન. આત્મા તરફ ગતિ કરવા માટે અસરકારક સાધન ધ્યાન છે. ધ્યાન દ્વારા જ મનુષ્ય પોતાની ચેતનાના ઊંડામાં ઊડા સત્રા સુધી પહોંચી શકે છે. અંતરનાં રહસ્યો ધ્યાનમાં જ પ્રગટ થાય છે. આત્માનો પ્રદેશ ધ્યાનમાં જ ખૂલે છે. આ વિષે સ્વામી વિવેકાનંદ કહે છે : ‘આધ્યાત્મિક જીવન માટે ધ્યાન એ સહુથી વધુ મજબૂત છે. ધ્યાનમાં આપણે ભૌતિક પરિસ્થિતિમાંથી છૂટા થઈ જઈએ છીએ. આપણા દિવ્ય સ્વભાવનું

આપણને ભાન થાય છે. ધ્યાનમાં આપણે કોઈ બહારની મદદ ઉપર આધાર રાખતા નથી. આત્માનો સ્પર્શ ખૂબ જ અંધકારમય જગ્યાને પણ ધડ્યા જ ઉજ્જવળ રંગોથી રંગી શકે છે. ખરાબમાં ખરાબ વસ્તુને પણ સુગંઘિત બનાવી શકે છે. પાપીને પણ તે દિવ્ય બનાવી શકે છે. એથી બધું વેર અને બધો સ્વાર્થ અદશ્ય થઈ જાય છે.' ધ્યાનથી આત્માનો સંપર્ક થતાં આત્માના ગુણો મનુષ્યના જીવનમાં પ્રગટ થાય છે. આત્માના ગુણો છે, પ્રેમ, આનંદ, ત્યાગ, સંવાદિતા, શાંતિ, શક્તિ. કોઈ પણ જાતની વિશેષ મહેનત કર્યા વગર માત્ર દરરોજ નિયમિત ધ્યાન કરવાથી જ આ ગુણો મનુષ્યને સહજપણે પ્રાપ્ત થાય છે. બાકી વિશ્વની કોઈ દુકાને, કોઈ પણ કિંમતે આમાંનો કોઈ પણ ગુણ ખરીદી શકતો નથી. આથી આત્માના દિવ્ય પ્રકાશમાં જો જીવન ધારણ કરતું હોય તો ધ્યાન અનિવાર્ય છે.

ઉંડા ધ્યાનમાં મનુષ્ય દેહભાવથી પર બની જાય છે. તેને પછી બાબ્ય જગતનું ભાન રહેતું નથી. તેવા મનુષ્યમાં અપાર તિતિક્ષા, ક્ષમા, ઉદારતા આવી જાય છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મહાવીર સ્વામીના જીવનમાંથી મળે છે. ભગવાન મહાવીરનું દીક્ષાનું તેરમું વર્ષ પસાર થતું હતું. વિહાર કરતા કરતા તેઓ છભ્માણિ ગામે આવ્યા હતા. સંધ્યા સમયે ગામની બહાર વૃક્ષ નીચે તેઓ ઉંડા ધ્યાનમાં મળ્યા હતા. આવા સમયે બળદનો ગોવાળ મહાવીરને પોતાના બળદોની દેખરેખ રાખવાનું કહીને ગામમાં ગયો. ઉંડા ધ્યાનમાં મળ મહાવીરને ગોવાળની વાત સંભળાઈ નહીં. બળદો તો ચરતા ચરતા ક્યાંય આગળ નીકળી ગયા. ગોવાળ પાછો આવ્યો. પૂછ્યું, 'મુનિ મહારાજ, મારા બળદો ક્યાં ?' મહાવીર એ જ ઉંડા ધ્યાનમાં લીન હતા. એમને આ પણ સંભળાયું નહીં એટલે બીજી વાર પૂછ્યું, પણ કંઈ જવાબ ન મળ્યો. ફરીફરીને પૂછ્યું પણ જવાબ જ નહીં એટલે ગોવાળ બિજાયો અને બોલ્યો : 'તું તે કેવો છે? આટાટલી વાર બરાદા પાડીને કહું છું તોય તું સાંભળતો નથી? તારે કાન છે કે કોડિયાં ?' મહાવીર તો એવા ઉંડા ધ્યાનમાં લીન હતા કે જ્યાં દેહાધ્યાસ હતો જ નહીં. સંભળાય તો જવાબ આપે ને? પણ કંઈ સંભળાતું જ નહોતું !

ગોવાળ ખૂબ ગુસ્સામાં આવી ગયો. એણે જીડા

ખીલા જેવા દર્ભશૂળ લીધા અને તેના બે છેડા કાનમાં નાખીને બરાબર ઠોક્યા અને તેના બહાર રહેલા છેડા કાપી નાખ્યા. આટલું બધું કરવા છતાં મહાવીર તો ઉંડા ધ્યાનમાં જ મળ રહ્યા. શારીરિક પીડા કેટલી ભયંકર હશે, પણ તેનીય તેમના ઉપર કંઈ અસર ન થઈ. ધ્યાન પૂરું થયું તોપણ એ જ સ્વસ્થતા અને શાંતિ એમના ચહેરા ઉપર વિલસતાં હતાં. એમના મનમાં ગોવાળ પ્રત્યે સહેજ પણ ગુસ્સાની લાગણી કે વેરભાવના ન આવ્યાં. પછી ફરી ધ્યાનમાં મળ હતા, ત્યારે એ જ કાષશલાકા તેમના કાનમાંથી બહાર ખેંચી કાઢવામાં આવી ત્યારે પણ તેઓ સ્વસ્થ હતા. આ વેદનાની તેમના પર કોઈ અસર ન થઈ. આ છે ધ્યાનનો ઉંડો પ્રભાવ.

મહાવીર સ્વામી તો સૈકાઓ પહેલાં થઈ ગયા, પરંતુ આ યુગમાં જ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ અને શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરિયાનંદજની પીઠ પર ૧૮૨૧માં એક ઘારું પડ્યું હતું. ડોક્ટરોને, પીઠમાં જ્યાં એ ઘારું પડ્યું હતું ત્યાંથી ઓપરેશન કરી માંસનો એક મોટો ટુકડો કાપી નાખવો જરૂરી લાગ્યો. તે માટે કલોરોફોર્મ આપી બેભાન બનાવીને પછી જ આવું ઓપરેશન કરી શકાય તેમ હોવાથી ડોક્ટરોએ એ માટેની તૈયારી કરી ત્યારે સ્વામી તુરિયાનંદજને કહ્યું : 'કલોરોફોર્મની જરૂર નથી. તમે તમારે જે કંઈ કાપકૂપ કરવી હોય તે કરો !' આવી પીડાદાયક શાશ્વકિયા વખતે તેમના મુખ પર દુઃખની એક રેખા ફરકી ન હતી. આ જોઈને ડોક્ટરો પણ આશ્રયમાં પડી ગયા હતા ! સ્વામી તુરિયાનંદજના જીવનમાં બે-ત્રાણ વાર શરીર પરની શાશ્વકિયા થઈ, પણ ક્યારેય તેમણે કલોરોફોર્મનો ઉપયોગ કરવા દીખો ન હતો ! ઉંડા ધ્યાનના પરિણામે દેહભાવથી પર થઈ જતાં દેહની પીડાની કોઈ અસર થતી નથી. આવા ઘણાં ઉદાહરણો આવા યોગી પુરુષોના જીવનમાંથી મળી રહે છે.

### સાચો આરામ મેળવવા દ્વારાની આવશ્યકતા

ખરેખરું ધ્યાન શરીર અને મનને પ્રકૃતિલિત બનાવે છે. શરીર અને મનને આરામ આપે છે. આ વિષે સ્વામી વિવેકાનંદ કહે છે કે, 'કલાકેકની ધ્યાનાવસ્થા પછી જ્યારે તમે તેમાંથી બહાર આવશો ત્યારે તમને તમારા જીવનના સુંદરમાં સુંદર આરામની અવસ્થાનો અનુભવ થયો

લાગશે. તમારું શરીરયંત્રને સારામાં સારો આરામ આપવાનો એકમાત્ર રસ્તો છે, ધ્યાન. જે ગાઢમાં ગાઢ નિદ્રા પણ તમને એવો આરામ નહીં આપે. આમ, ઉંડા ધ્યાનમાં શરીરને, જ્ઞાનતંતુઓને અને મનને સાચો આરામ મળી જાય છે, જે કલાકોની નિદ્રામાંથી પણ મળતો નથી.' આથી જેઓ ઉંડું ધ્યાન કરતા હોય તેમને નિદ્રાની ઓછી જરૂર પડે છે અને છતાં તેમનાં તન અને મન તાજગીથી ભરેલાં રહે છે. પરિણામે સામાન્ય મનુષ્ય જે કાર્ય કરે છે તે કાર્ય તેઓ ઓછા સમયમાં વધારે ઝડપથી કરી શકે છે, આથી ધ્યાન દ્વારા સમય અને શક્તિ બંનેમાં વૃદ્ધિ કરી શકાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ધ્યાનની શક્તિ આપણને સર્વ કંઈ મેળવી આપે છે. જો તમારે પ્રકૃતિ ઉપર સત્તા મેળવવી હોય તો તે તમને ધ્યાન દ્વારા મળી શકે. જે બધી વૈજ્ઞાનિક શોધો થઈ રહી છે તે બધી ધ્યાનની શક્તિ દ્વારા થાય છે.

આમ, ધ્યાન દ્વારા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શક્તિઓનો વિકાસ, આંતારિક શક્તિઓની જાગૃતિ, દૈનિક જીવનમાં સ્વસ્થતા, સમતા, સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. આજે વિશ્વના મોટા ભાગના દેશો એટલે જ ભારતના યોગ અને ધ્યાન પ્રત્યે આકર્ષિત થયા છે. તાજેતરમાં જ એક વર્તમાનપત્રમાં સમાચાર હતા કે જર્મનીમાં યોગના નવા નવા કેટલાય વર્ગો શરૂ થયા છે. અમેરિકામાં પણ હવે ઘણા લોકો ધ્યાન અને યોગ પ્રત્યે વળ્યા છે. 'ટાઈમ' (Time) મેગેਜીનના ઓગસ્ટ ૨૦૦૩ના ધ્યાન વિશેના વિશેષાંકના મુખ્યપૂર્ણ પર ધ્યાન કરતી સીનો ફોટો છાપવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે દરરોજ ઓછામાં ઓછા એક કરોડ અમેરિકન લોકો નિયમિત ધ્યાન કરે છે. અમેરિકનોના જીવનમાં ધ્યાન એટલું મહત્વાનું બની રહ્યું છે કે બોર્ડરમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, એરપોર્ટ પર બધી જગ્યાએ ધ્યાન માટેની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. ભારતમાંથી કેટકેટલાય સાધુસંતો અમેરિકા અને યુરોપમાં યોગ શીખવવા માટે જાય છે, જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીની સિદ્ધિઓ વધતી જશે તેમ તેમ માનસિક શાંતિ અને સ્વસ્થતા માટે અને સારી રીતે જીવન જીવવા માટે ધ્યાનની પણ એટલી જ જરૂરિયાત વધતી જશે.

(‘એકાગ્રતા અને ધ્યાન’માંથી સાભાર)



## આયંકદંસી ણ કરેઝ પાવં

આચારાંગ સૂત્ર

આચાર્ય વિજયરત્નસુંદરસૂત્રિજી

આગ તરફ કદમ ડાહ્યો માણસ મૂકતો નથી,  
ખાડામાં ખુલ્લી આંખવાળો માણસ પડતો નથી,  
મોઢામાં ઝેર સમજુ માણસ નાખતો નથી,  
વીસમા માળેથી કૂદકો અક્કલવાન  
માણસ લગાવતો નથી.

પણ પ્રભુ !

આપ તો એમ ફરમાવો છો કે  
જે દીર્ઘદર્શી હોય છે તે પાપ કરતો નથી.  
જીવન અમારું જોતાં અમને એમ લાગે છે કે  
અમારી પાસે દીર્ઘદર્શિતા નથી.  
કારણ કે પાપો અમારા જીવનમાં બે-રોકટોક ચાલુ છે,  
પુરબહારમાં ચાલુ છે.

આંખે દૂરભીન લગાવીને આકાશમાંના  
તારા જોવાના બાલિશ પ્રયત્નોમાં  
આ જીવનની કીમતી પળો વેડફી રહેલા અમને

હે પ્રભુ !

એવી નિર્મણ દણ્ણ આપો કે  
જેના સહારે પાપસેવનમાં ધરબાયેલાં  
દુગ્ધતિનાં જાલિમ દુઃખો અમે જોઈ શકીએ  
અને એ જોતાંવેંત અમારા મનને અને  
જીવનને અમે પાપોથી મુકત કરી દઈએ.

‘પ્રભુ વીર કહે છે’ માંથી સાભાર

## મૂર્તિપૂજા

શક્રેય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી



### મૂર્તિપૂજામાં ધ્યાનનું મહત્વ :

ધ્યાન એ શાસ્ત્રીય પ્રક્રિયા છે; તેથી ધ્યાનમાં પ્રભુની મૂર્તિ કેવળ આંખની સામે રાખીને ન ચાલે, તેમાં તલ્વીનતા લાવવી જોઈએ. ફક્ત મૂર્તિ અને આપણે, એ બે સિવાય બીજું બુધું ચાલ્યું જવું જોઈએ. જાડ નીચે ભગવાન મુરલીધર શ્યામ ઉભા છે અને હું તેમના પગે પડ્યો હું; આ એક જ ચિત્ર રહે. બાકી કોઈ અવાજ, વસ્તુ, પદાર્થ, વિચાર, સંકલ્પ, કામના, ઈચ્છા કશું જ નહિ, આવી સ્થિતિ આવે તે માટે અભ્યાસ કરવાનો હોય. આ યોગ સાધવા માટે ધ્યાનની સામગ્રી એકદી કરવી જોઈએ.

લોકો સામગ્રીમાં ચંદન, ચોખા, ફૂલો વગેરે લાવે છે. ખરું જોતાં એ ભક્તિની સામગ્રી નથી, પણ ઉપસનાની સામગ્રી છે. વિશુદ્ધ બુદ્ધિ એ ધ્યાનયોગની પ્રથમ સામગ્રી છે. વિશુદ્ધ બુદ્ધિ એટલે જે બુદ્ધિ કામનાગ્રસ્ત નથી તે. જે ક્ષણે આપણે ધ્યાનમાં બેસીએ તે ક્ષણે મને આ જોઈએ, આ ઓછું છે, આ નથી જોઈતું - એવા વિચારો ન આવવા જોઈએ.

જીવનનો વૈભવ જોવાની ટેવ પાડવી જોઈએ. જીવનમાં જે નથી તેના દુભૂતિયની ચર્ચા ન કરતાં ભગવાન પાસે બેઠા પછી કહેવું જોઈએ, ‘હે ભગવાન ! તારા દર્શનથી હું પાવન અને પુણ્યકારક થયો હું - પુણ્યોડહં તવ દર્શનાત્ ।’ આપણી પાસે જે ‘નથી’ તેની યાદી ન કરતાં, જે ‘છે’ તેની યાદી કરવી જોઈએ. જીવનમાંની અધિતના વિચારો આવે ત્યાં સુધી ચિત્ત એકાગ્ર થાય નહિ અને ચિત્ત એકાગ્ર થયા વગર ભક્તિ સંભવતી નથી. ચોવીસ કલાક કોઈ કામનારહિત રહી શકતું નથી, પરંતુ જ્યારે ધ્યાનયોગ કરવા બેસીએ તેટલો વખત પણ બુદ્ધિ અહંકાર અને વાસનારહિત રાખવી અનું જ નામ વિશુદ્ધ બુદ્ધિ. બુદ્ધિમાંથી અહંકાર જવો જોઈએ. અહંકાર

અને વાસના નહિ - એ સ્થિતિ તે વિશુદ્ધ બુદ્ધિની સ્થિતિ છે.

મનોનિગ્રહ એ ધ્યાનયોગની બીજી સામગ્રી છે. મનોનિગ્રહ કરવા માટે મનને સમજવું જોઈએ, સાંભળવું જોઈએ તેમ જ તેને અંકુશમાં રાખતાં આવડવું જોઈએ.

મનને સમજવું એટલે સૌથી પહેલાં તો આપણાને આપણા મનની નબળાઈઓ તેમ જ દોષો ખબર હોવા જોઈએ. તે માટે કોઈ પાસે આપણું હદ્ય ખોલીને બેસવું જોઈએ. આ હેતુથી જ અધ્યાત્મમાં ગુરુની જરૂર છે. આપણી નબળી-દૂબળી તેમ જ તેજસ્વી અને પરાકમની એમ બંને વાતો કોઈકની પાસે કહેવી એ મનોવિકાસ માટે જરૂરી છે. માત્ર નબળી વાતો કહેવાથી ન્યૂનગંડ નિર્માણ થાય અને માત્ર પરાકમની વાતો કહેવાથી અહંગંડ નિર્માણ થાય. મનથી ખુલ્લા થાઓ - એમ શાખકારો કહે છે તેનું આ જ કારણ છે.

ધ્યાનયોગની ત્રીજી સામગ્રી એટલે વિષયોમાંનું વિષયપણું કાઢી નાખવું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ વિષયો જીવનમાં આવશ્યક છે, પરંતુ તેના તરફ જોવાનો ઉપભોગનો દાખિકોણ કાઢી નાખવો જોઈએ. તાત્ત્વિક દાખિએ જોતાં મુરલીધર શ્યામનું ચિત્ર મનમાં ઉભું કરીએ તે પણ વિષય ગણાય. કનક અને કાન્તા એ જ વિષયો માનવા એ છીછારું જ્ઞાન છે. પુસ્તક પણ વિષય છે. વિચાર પણ વિષય છે અને ભગવાન પણ વિષય છે. આ જગતનું સૌંદર્ય જોયા પછી તેને પાસે લેવાનું આપણને મન થાય, પરંતુ તે ભોગની દાખિથી લેવું કે ભક્તિની દાખિથી લેવું એ મહત્વનું છે. સૃષ્ટિ તરફ ભક્તિની નજર હોવી એ મુખ્ય વાત છે.

વિષયત્વ વસ્તુ કે વ્યક્તિમાં નહિ, પરંતુ મનમાં છે. નાના બાળક માટે સુંદર તેમ જ યુવાન એવી સ્વી

પણ વિષય નથી. ફૂતરાને માટે સોનું એ વિષય નથી. જિતેન્દ્રિય અને મનોવિજ્ઞ્યી એવા યોગીને માટે કનક કે કાન્તા વિષયરૂપ હોતાં નથી.

ધ્યાનયોગનો અભ્યાસ કરવાવાળાએ રાગ-દ્વેષોથી દૂર રહેવું જોઈએ. કોઈની આસક્તિ નહિ તેમ કોઈનો દ્વેષ પણ નહિ, કોઈનું ભલું થાય તે માટે હું પૂજા કરતો નથી તેમ કોઈનું બૂઝું થાય તે માટે પણ મારી પૂજા નથી.

ધ્યાનયોગના અભ્યાસ માટે મનને એકાંતવાસની પણ ટેવ પાડવી જોઈએ. એકાંતવાસ એટલે હું એકલો હોઉં એવી સ્થિતિ. ભૂતકાળ નહિ, ભવિષ્યકાળ નહિ તેમ જ વર્તમાનકાળ નહિ. આવી એકાકી સ્થિતિમાં રહેતાં આવડવું જોઈએ.

ધ્યાનયોગીએ મિતાદારી રહેવું જોઈએ. કેવળ જમવાનો આદાર મિતાદાર રહે એટલું જ નહિ, બધી જ ઈન્દ્રિયોનો મિતાદાર રહેવો જોઈએ. કારણ બધી જ ઈન્દ્રિયોને વિષયો જોડે સંબંધ છે; વિષયો ઈન્દ્રિયોનો આદાર છે.

ધ્યાનયોગની સાધનામાં વાણી, કાયા અને મનનું નિશ્ચિત ધેય તરફનું ખેંચાશ હોવું જોઈએ. યોગદર્શનકાર કહે છે કે, ભક્તિ કરવા બેસો ત્યારે બદ્ધપદ્માસન કરો. કાયા, વાણી, મન એ બધાનું એકસાથે નિશ્ચિત ધેય તરફ ખેંચાશ થવું જરૂરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મન જ્યારે ધ્યાનમાં જાય ત્યારે કોઈ પણ પ્રકારના વાસના-વિકાર સાથે હોવા ન જોઈએ, તેથી જ તો ભગવાનમાં તલ્લીન થવાવાળા લોકોને ભગવાન પાસે કંઈ માગવાનું રહેતું નથી. તે વખતે તેમની કોઈ પણ જરૂરિયાતોની સ્મૃતિ તેમની સાથે હોતી નથી. ઘણા લોકો તુકારામને પૂછ્યા, ‘ભગવાન તમને રોજ મળે છે તો પછી ભગવાનને કેમ કહેતા નથી કે મારો વેપાર ચાલતો નથી?’ ભગવાનમાં તલ્લીન થયેલાની મનની સ્થિતિ જ જુદી હોય છે. તેમને તે વખતે વેપાર કે વ્યવહાર કંઈ જ યાદ હોતું નથી. અજ્ઞાની લોકો આ વાત સમજી શકતા નથી અને તેથી પ્રભુના સાચા ભક્તની ટીખળી ઉડાવે છે.

વૈયક્તિક જીવન વિસંગત અને ધેયશૂન્ય હોય તો ચિત્તઅનુભૂતા થાય નહિ. વિચાર અને આચારમાં અંતર હોઈ શકે, પરંતુ વિસંગતિ ન હોવી જોઈએ. ગીતાકારે આ વાતનું સુંદર નિર્દેશન કર્યું છે :

**શુચૌ દેશો પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્રમઃ**

**નાત્યुચ્છ્રંતં નાતિનીચं ચૈલાજિનકુશોત્તરમ् ॥ ૬/૧૧॥**

ચિત્તેકાળના અભ્યાસ માટે સ્થળકાળનું પાવિત્ર્ય અપેક્ષિત છે. ટ્રેનમાં કે બજારની ભીડમાં ચિત્તઅનુભૂતા શક્ય નથી.

સ્થળકાળનિરપેક્ષ સમાધિ કોઈકને લાગતી હોય તો તે અપવાદરૂપ છે. આવો માણસ કરોડોમાં એકાદ મળે. જેના માટે કહેવાય છે કે - સાધો સહજ સમાધિ ભળી રહી હોય ।

અભ્યાસ કરનાર માણસનું આસન સ્થિર હોવું જોઈએ. સ્થિરસુખમાસનમ् । (યો.સૂ.) તદુપરાંત આત્મગૌરવ અને ઈશ-વિશ્વાસ આ બે વાતો જીવનની બેઠકમાં હોવી જોઈએ. (Reverence for self)માં ‘હું હલકો નથી, સૂચિ ખરાબ નથી અને જીવન સજી નથી.’ આ ત્રાણ વાતોનો સમાવેશ થાય છે. ઈશવિશ્વાસમાં ‘હું ભગવાનનો છું અને ભગવાન માટે છું’ - આ ભાવ દદ્ધ થવો જોઈએ. સંસાર સત્ય છે એમ માનીએ તો આસક્તિ ઊભી થાય; અસત્ય છે એમ માનીએ તો જ વિરક્તિ નિર્માણ થાય. તેથી સંસાર સત્ય પ્રભુનો છે એમ માનીએ તો જ અનુરક્તિ આત્મગૌરવ પેદા થાય.

‘હું હલકો નથી તેમ મહાન પણ નથી’ ‘નાત્યુચ્છ્રંતં નાતિનીચ’ ‘હું મહાનનો છું, ભગવાનનો છું; મારા સ્વામી નારાયણ છે, આમાં એક મધુર અહેકાર છે જે ભક્તિને પોષક છે.’

ધ્યાનયોગની સામગ્રીમાં વૈરાગ્ય પણ અપેક્ષિત છે. વૈરાગ્ય એટલે તે ક્ષણે કોઈ પણ જીતની અભિલાષાનો અભાવ; જીવનાભિલાષા પણ નહિ અને ભરણાભિલાષા પણ નહિ - આવી એક સ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

‘મૂર્તિપૂજા’માંથી સાભાર

## સદવાણી

શ્રી શ્રી મા આનંદમયી



【શ્રી શ્રી મા આનંદમયી (૧૮૮૬-૧૯૮૨)નું મૂળ નામ નિર્મલાસુંદરી હતું- લગ્ન પછી ગૃહસંસાર સ્થાપવાનો સમય આવ્યો ત્યારે માની આધ્યાત્મિક ઓરાનો જ્યાલ કુટુંબના બધા સર્વોને આવી ગયો. શ્રી માના શરીરમાં અલૌકિક સાધનાની કિયાઓ આપમેળે થતી હતી. શ્રી માને કોઈ સંપ્રદાય નથી. ધીમે ધીમે ભક્તમંડળ વધવા માંડ્યું. તેઓ માતૃશક્તિનું સાક્ષાત્ સ્વરૂપ હતાં. ભારતમાં અનેક સ્થળે આશ્રમો સ્થાપા. જે આજે પણ સરસ રીતે ચાલી રહ્યા છે. છેલ્લા શબ્દો હતા “આ શરીર મનુષ્યદેહે આવ્યું છે તેથી તે જ રીતે જશે.” સહુનાં મા એવાં શ્રી મા આનંદમયીએ તા.૨૭-૮-૧૯૮૨ના દિને મહાપ્રયાશ કર્યું.]

### સાચો પ્રકાશ

બેઠાં બેઠાં અંધકારમાં ગોથાં કેમ ખાધાં કરો છો ? પ્રકાશની શોધ કરો. કોરિયાના દીવાથી અથવા હિલેક્ટિક લાઇટથી કેટલા દિવસ પ્રકાશ મળશે ? જ્યારે તેલ ખૂટી જશે ને લાઇટની સ્વિચ બગડી જશે એટલે ફરી પણો અંધકાર ફરી વળશે. તેથી એવા પ્રકાશથી સંસારને અજવાળો કે કદી પણ જાંખો ન પડે-ખૂટે નહિં. એવો પ્રકાશ કયો છે તે તમે જાણો છો ? એ છે ભગવત્પ્રેમ અને ભગવત્સ્થિષ્ઠા. ઘેર ઘેર એ પ્રકાશ પહોંચાડવાની શરૂઆત કરો ત્યારે તમને જણાશો કે આત્મબાધ્ય બધું જ પ્રકાશમય બની ગયું છે. અંધકારનું નામ પણ પછી નહિં રહે.

### માતાઓની ઉંનાતિ જરૂરી

એક વાત ધ્યાન રાખજો કે પ્રભુના કાર્યમાં તમારે સ્વીઓનો-માતાઓનો સહકાર-આશ્રય માગવો પડશે; કેમ કે સમાજની સાચી કષ્ણધાર સ્વીશક્તિ છે ને તેમના સિવાય પુરુષો એકલા ઉન્નત પંથમાં પ્રગતિ કરી શકે નહિં. છોકરાઓની સાથોસાથ છોકરીઓને પણ હરિકીર્તનમાં સામેલ કરો, એમને ગીતા વગેરે ધર્મશાસ્કો ભષાવો, જ્ય, ધ્યાન વગેરેમાં તેમનું મન વાળો અને સાધુસંતોનો સત્સંગ કરાવો. આમ થશે ત્યારે સ્વી-પુરુષો એકીસાથે ઉન્નતિ પ્રાપ્ત કરશે. પહેલાં જેમ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન થતું હતું, તેવી જ વ્યવસ્થા કરવાથી જ હિંદુ ધર્મ એક વાર ફરીથી જાગૃત થશે.

### ધર્મ-પ્રાપ્તિ

માતાની પિછાન જેમ તેનાં સ્નેહ અને માયાળુતાથી થાય છે, પત્નીની પિછાન જેમ તેના પ્રેમ અને અનુરોગથી થાય છે તેમ જ મિત્રની પિછાન જેમ તેની પ્રીતિ અને આત્મભાવથી થાય છે તેવી જ રીતે ધર્માનુરોગી

મનુષ્યની પિછાન તેના ધર્મચરાશ પરથી થાય છે. ધર્મમાં મારો વિશ્વાસ છે એમ બોલવા માત્રથી ચાલશે નહિં; કર્તવ્યમાં તેને ઉતારી બતાવવું પડશે. સંયમ, નિયમ, ઉપવાસ જાગરાત વગેરે કલેશકારક તપસ્યાઓ કરી પણ હદ્યની જડતા દૂર ન થઈ, ભાવનાથી હદ્ય રંગાયું નહિં તો પછી આ કર્મો માત્ર સત્તસંસ્કાર પૂરતાં આવકારદાયક બનશે, પણ મનુષ્યને ધાર્મિક નહિં બનાવે, માટે હદ્યર્પણમાં પોતાના દોષ જુઓ અને જે જે દોષ જણાય તેને દૂર કરવાના તત્કાળ પ્રયત્ન કરો. એ રીતે જે સ્થિતિમાં છો ત્યાંથી ધીરે ધીરે આગળ વધો એટલે વખત આવતાં તમારાં કર્મ અને ભાવનાના સંયુક્ત બળો તમને ધર્મની પ્રાપ્તિ થશે.

### પૂર્વ શાંતિ

શાંતિની શોધમાં સારુંય જગત ભમી રહ્યું છે, પરંતુ કોઈ એમ બોલતું જણાતું નથી કે સાચી શાંતિ હદ્યમાં જ જાગૃત થાય છે અને તે સિવાય બીજા કોઈ પણ ઉપાયથી શાશ્વત શાંતિ મળનાર નથી. પૈસા કમાવાય, કુટુંબ-પરિવાર થાય તેમ જ માન-આબરૂ વધે, છતાં પણ શાંતિ મળતી નથી; કેમ કે આ બધી સાંસારિક વસ્તુઓ છે તેમ જ દિવસ રાત્રિની માફક પરિવર્તનશીલ છે. જોતજોતામાં એ આવે છે ને ચાલી જાય છે, તેથી જ એવા ધનની પ્રાપ્તિ કરી માલદાર બની જાવ કે જે ધનનો કદી પણ નાશ ન થાય અને મળ્યા પછી તમામ કામનાઓ અદશ્ય થઈ જાય. એ ધન માત્ર એક ભગવાન છે, જે બધાનાં હદ્યમાં રહ્યા છતાં બધાથી અજાણ્યા છે. સત્કર્મો દ્વારા જ્યારે અંતરનો અંધકાર દૂર થાય છે ત્યારે એ સુંદર, વિશ્વમોહક રૂપ હદ્યકમળમાં સ્વયં પ્રકટ થયેલું દેખાય છે ને ત્યારથી જ પૂર્ણ શાંતિના સાપ્રાજ્યનો હદ્યમાં આરંભ થાય છે.

‘માતૃદર્શન’માંથી સાભાર

## પ્રસંગ-વાતી

પપા સ્વામી રામદાસ



સને ૧૯૫૭માં મહાત્મા શ્રી દિલીપકુમાર રાય અને ઇન્દ્રિયાદેવીના નિમંત્રણથી પપા અને માતાજી પુણે ખાતે તેમના શ્રી હરિકૃષ્ણ મંદિરમાં ત્રણ દિવસ રહ્યા હતા. ‘બંસી આજે પણ બજે છે’ એ ગ્રંથમાં દિલીપદાદાએ અનો ખૂબ સુંદર હેવાલ લખ્યો છે. માતાજી વિષે તેઓ કહે છે : ‘માતાજી પ્રભુના અનુગ્રહનું પુષ્પ છે જે કેવળ સુંગંધ નથી વહાવતું, પણ જે હાજર છે તે સૌ પ્રત્યે સ્થિત વેરે છે. યોગીઓનો ‘સહજિયા’ શબ્દ માતાજીને બરાબર લાગુ પડે છે. હું એમને શરમાળ કે ભીરુ નહિ કહું. કારણ, જ્યારે દઢ થવું જોઈએ ત્યારે તેઓ દઢ થઈ શકે છે. એક શાળાએ અમુક સમયે પપાને પધારવાનું નિમંત્રણ આપ્યું. પપાએ તરત એનો સ્વીકાર કર્યો, પણ માતાજી કહે : ‘એ નહિ બને ! પપા તો બધું કબૂલ કરશે. તેઓ સાવ બાળક છે. તમે સમય ફેરવો !’ છેવટે શાળાએ માતાજીએ કહેલો સમય સ્વીકારવો પડ્યો. આથી પપા કહે છે : ‘રામદાસ તો માત્ર બોલવામાં સમજે છે, કામ કરનાર તો માતાજી છે !’

‘પપા અને માતાજીનો સંબંધ અપૂર્વ આધ્યાત્મિક છે. આવો સુંદર આધ્યાત્મિક સંબંધ આવી સહજ રીતે પુષ્પિત થયેલો મારા જીવનમાં મેં બીજા કોઈ સંતોમાં જોયો નથી !’

‘રોજ પ્રશ્નોત્તરીની ભારે રમજાર જામતી. એમની બોલવાની ટબમાં વિશિષ્ટ મોહિની હતી અને એ બધામાં કલગીરૂપ હતું એમનું બાળકના જેવું હાર્ય ! એ હાર્ય ધાર્યું નિશાન પાડે એવું અચૂક હતું !’

પપાએ અહીં સાધનાકાળે પોતાને થયેલા બાલકૃષ્ણનાં દર્શનની વાત કરી. વચ્ચમાં જ દિલીપદાદાએ પૂછ્યું : ‘એ વખતે તમારી આંખો ઉધાડી હતી કે બંધ ?’

પપાએ કહ્યું : ‘ઉધાડી ! અત્યારે ઉધાડી છે તેવી જ !’

‘વાતવાતમાં પપાએ કહ્યું કે તેમણે પશ્ચિમના લોકોને ખાતરી આપી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ નહિ થાય !’

દિલીપદાદાએ પૂછ્યું : ‘આ તમારો અંગત અભિપ્રાય છે કે રામ તરફથી પ્રાપ્ત થયેલું દર્શન છે ?’

જવાબમાં પપાએ લખી દીધું : ‘રામની પ્રેરણાથી રામદાસે આ કહ્યું હતું. તમે અને જરૂર ‘દર્શન’ (રેવેલેશન) કહી શકો !’

પપાના માનમાં ઇન્દ્રિયાદેવીએ એક કાવ્ય લખ્યું હતું, જે સૌએ તેમની હાજરીમાં ગાયું હતું. કાવ્યમાં આ લિટીઓ હતી :

ધન્ય ધરણી ચર્ણ તરે હંદયસે લગાઈ,  
ધન્ય પ્રેમી આજ તરે ધન્ય કૃષ્ણાબાઈ !  
રામ બના રામદાસ, ખેલ હૈ રચાયા,  
જ્ય શ્રી રામ, જ્ય જ્ય રામ,  
જ્ય જ્ય રામ ગાયા !

ગીત પૂરું થયા પછી પપાએ કહ્યું : ‘હું અહીં પ્રેમનું આંદોલન અનુભવું દું.’

દિલીપદાદાએ કહ્યું : ‘મૂડીમાં અમારી પાસે કેવળ પ્રેમ છે. અમે માત્ર બે ટીપાં –’

પપાએ વચ્ચમાં જ કહ્યું : ‘બે ટીપાં નથી, તમે તો નિર્મણ પ્રેમનું આખું સરોવર છો. જુઓને, એ શીતલ સરોવરમાં ડુબકીઓ મારી મારીને મારું તો ગળું બેસી ગયું !’

વાત એમ હતી કે સવાર-સાંજ પ્રશ્નોના જવાબ આપી આપીને એમનું ગળું બેસી ગયું હતું !

દિલીપદાદાએ અંગ્રેજ અને બંગાળીમાં એક સુંદર ગ્રંથ લખ્યો છે, જે ગુજરાતીમાં ‘ચમતકારો આજે પણ બને છે’ એ નામે જાણીતો છે. આ ગ્રંથમાં આનંદગિરિ નામે સંતનું અદ્ભુત પાત્ર છે. પાછળથી દિલીપદાદાએ જાહેર કર્યું છે કે એ પાત્રની પ્રેરણા એમને પપા રામદાસમાંથી મળી હતી ! પપા આવા અદ્ભુત સંત હતા. ભાગવતમાં કહ્યું છે કે ‘ગંગાજળ પણ માણસને શુદ્ધ કરતાં સમય લેશે, પણ સંતનો એક જરીક જેટલો સ્પર્શ પામીને પુષ્યશાળી કરી દેશે.’

‘પપા સ્વામી રામદાસ’માંથી સાભાર

## ઉપનિષદ-યાત્રા

શ્રી ગુણવંતભાઈ શાહ



### વાણી તો પૃથ્વીની જિહ્વા છે

**અધિના શબ્દો :** વાચઃ પृથિવી શરીરમ् । (બૃહદારણ્યક ઉપનિષદ, પ્રથમ અધ્યાય, બ્રાહ્મણ ૫, મંત્ર ૧૧)  
**ભાવાર્થ :** પૃથિવી તો છે, વાણી કેરું શરીર !

#### મૌન એટલે વાણીનો અભાવ નહીં

એક ઓરડાના દરવાજે બહારથી તાજું મારેલું છે. એ ઓરડામાં કોઈ જ હાજર નથી, તેથી એમ ન કહી શકાય કે એમાં મૌનનો નિવાસ છે. થોડી વાર પછી એ જ ઓરડામાં એક મનુષ્ય પ્રવેશે છે. જો એ માણસ શાંત ચિત્તે સ્વસ્થતાપૂર્વક પોતાની વાણીને વિરામ આપે તો ઓરડામાં મૌનનો નિવાસ છે એમ જરૂર કહી શકાય. મૌન એટલે વાણીનો અભાવ નહીં; મૌન એટલે પ્રશાંત મનની અનાકુલ અવસ્થા.

કલ્પના કરો કે પૃથ્વી પર વસતા તમામ મનુષ્યો એકાએક વાણી ગુમાવી બેસે છે. આવી વાણીવિહીન પૃથ્વી પર મૌન ઉદ્ભબ્યું એમ નહીં કહી શકાય. વાણીનું વરદાન કેવળ મનુષ્ય તરીકે ઓળખાતા પ્રાણીને જ મળ્યું છે. મનુષ્યો વચ્ચે થતા પ્રત્યાયનનું એક માધ્યમ વાણી છે. મૌન એટલે સૂક્ષ્મતમ કક્ષાએ થતું પ્રત્યાયન. તેથી કહ્યું : ‘ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનમ् ।’

વિવેકયુક્ત વાણી દ્વારા મનુષ્યની શોભા પ્રગટ થાય છે. ભર્તૃહરિ એવી વાણીને ‘સંસ્કૃતા વાણી’ કહે છે. ભર્તૃહરિ કવિહદ્યનો રાજવી હતો. એણે ‘નીતિશતક’ના એક શ્લોકમાં કહ્યું :

ન તો કેયુર (બાજુબંધ),  
 ન તો ચંપ જૈવા ઉજ્જવળ રત્નહાર,  
 ન તો સ્નાન, ન તો ચંદનનું વિવેપન,  
 ન તો સુગંધિત પુષ્પો, ન તો શાણગારેલા વાળ  
 મનુષ્યને શોભા આપે છે.

#### વાસ્તવમાં

માણસ જે સંસ્કારસંપત્ત વાણી પ્રયોજે  
 તે જ એને સુશોભિત કરે છે.  
 આભૂષણો તો રોજ રોજ ક્ષીણ થતાં રહે છે,  
 પરંતુ  
 વાણીરૂપી આભૂષણ જ ખરેખરું આભૂષણ ગણાય.

#### વાણી થકી માણસ પ્રગટ થાય છે

વાણી દ્વારા મનુષ્ય પ્રગટ થતો રહે છે. ચાલાક મનુષ્ય પોતાની વાણીને અસત્યથી અભડાવે અને પોતે હોય તેના કરતાં જુદે સ્વરૂપે પ્રગટ થવામાં ગૌરવ પણ અનુભવે છે. આવું કરતી વખતે તેણે પોતાના માંહ્યલાને છેતરવો પડે છે. ધીરે ધીરે માંહ્યલાને છેતરવાની ટેવ પડી જાય અને લોકો વાતવાતમાં કહે છે : માણસ સ્માર્ટ છે. આજકાલ સચ્ચાઈ વગરની સ્માર્ટનેસની બોલબાલા વધી પડી છે. વાણીનું વરદાન પામેલા મનુષ્ય દ્વારા વરદાનનો દુરુપ્યોગ થતો રહ્યો છે. વાણી દ્વારા થતી વિકરાળ છેતરપિંડીનો પાર નથી. લાંબા ગાળે આવી સ્માર્ટનેસ ઘણી મોંઘી પડે છે. એવી સ્માર્ટનેસનો રેલો ‘સ્માર્ટ બોંબ’ સુધી પહોંચ્યો છે. આવા બોંબની દિમાયત અમેરિકાના પ્રમુખ આઈજનહોઅરે કરેલી.

સદ્ગત નગીનદાસ પારેખનું સ્મરણ થાય છે. મિત્ર ભોળાભાઈ પટેલે નગીનદાસભાઈ કેટલા સાચાબોલા અને આખાબોલા હતા તેની વાત કરેલી. નગીનદાસ કહેતા : ‘હું વાતવાતમાં કોઈને ધમકી આપું કે તું આમ કરે તો હું તને તમાચો ઢોકી દઈશ. પછી જ્યારે આદમી એ પ્રમાણો કરે, ત્યારે જો હું એને તમાચો ન મારું તો તેય અસત્ય જ ગણાય.’ આવી વાણી ભલે ખરબચ્ચી લાગે, પરંતુ એમાં રહેલો સચ્ચાઈનો રણકો બુલંદ જગ્યાય છે. મનના અને માંહ્યલાના સથવારા વગરની અનાથ વાણીને કારણે થતા નુકસાનની સરખામણીમાં કદાચ તમાચો પણ સસ્તો પડે છે. મનમાં હોય તેનાથી સાવ જુદું બોલવામાં વાણીનું તપ નંદવાય છે.

#### વાણી, મન અને પ્રાણ

બૃહદારણ્યક ઉપનિષદમાં ગ્રણ પ્રકારના અમની વાત થઈ છે. એ ગ્રણ અમ તે વાણી, મન અને પ્રાણ (શાસ). માણસ જે કંઈ જુએ કે સાંભળે તે મન દ્વારા

જ પામે છે. આપણું મન બીજે હોય ત્યારે સામે બેઠેલા ભિત્રની વાત સાંભળતા નથી હોતા. તે જ વખતે ટીવી પરથી પ્રસારિત થતું ગીત આપણા કાન ઝીલતા રહે છે. મન વિચારે ચડી જાય ત્યારે સામે ઉભેલું વૃક્ષ નથી દેખાતું અને ગેરહાજર એવું પ્રિયજન દેખાય છે. મિત્ર સાથે વાત ચાલતી હોય ત્યારે મન વાતમાં પરોવાયેલું હોય છે, તેથી કોયલના ટહુકા પણ માણસને નથી સંભળતા. આમ, માણસ જે કંઈ જુએ કે સાંભળો તે અંતરોગત્વા મન દ્વારા જ જુએ કે સાંભળો છે. ઋષિ કહે છે કે આપણો આત્મા મનોમય, વાણીમય અને પ્રાણમય છે (અયમાત્મા વાઙ્મયો મનોમય: પ્રાણમય:).

આટલું કહીને અટકી જાય તો ઋષિ શેના ! તેઓ આગળ વધીને કહે છે :

- વાણી પૃથ્વીલોક છે (ભૂ:)
- મન અંતરિક્ષલોક છે (ભૂવઃ)
- પ્રાણ સ્વર્ગલોક છે (સ્વ:)

હજુય વાત આગળ ચાલે છે અને ઋષિ કહે છે :

- વાણી જ ઋગવેદ છે.
- મન જ યજુર્વેદ છે.
- પ્રાણ જ સામવેદ છે.

જે કંઈ જાણેલું (known) છે, તે વાણીનું સ્વરૂપ છે. જે કંઈ જાણવાયોગ્ય (knowable) છે, તે મનનું સ્વરૂપ છે અને જે કંઈ અવિજ્ઞાત (unknown) છે, તે પ્રાણનું સ્વરૂપ છે. આટલી ભૂમિકા પદી ઋષિ એક વિધાન કરે છે : વાચ: પૃથ્વીની શરીરમ् । પૃથ્વીને ઋષિ વાણીનું શરીર ગણાવે છે. તેમાં જ્યોતિર્દ્રષ્ટે અન્નિ રહેલો છે. ઋષિ કહે છે કે જેવી વાણી છે, તેવી પૃથ્વી છે અને અન્નિ પણ તેવો છે.

### સમગ્ર પૃથ્વી વાણીથી છવાયેલી છે

દુનિયાની અન્ય કોઈ સંસ્કૃતિમાં વાણીનો આવો મહિમા થયો હશે ખરો ? આપણી વાણી સ્થૂળસ્વરૂપા કે પૃથ્વીસ્વરૂપા જણાય છે, પરંતુ એનો સંબંધ તો સૂક્ષ્મ મન અને પ્રાણ સાથે રહેલો જણાય છે. પૃથ્વી પર થતો વાણીબ્યવહાર મહદૂંશે પૃથ્વી પર પાંગરેલા મનુષ્યત્વની ગુણવત્તા નક્કી કરે છે. જેવી વાણી, તેવી મનુષ્યતા. આમ, સમગ્ર પૃથ્વી વાણીથી છવાયેલી છે. એ વાણી પૂર્થક નથી. એનો નાળસંબંધ માનવીનાં મન અને પ્રાણ

જોડે રહેલો છે. વાણી જળવાઈ જાય તો બીજું બધું જળવાઈ જાય. વાણી ખોરવાય તો બીજું બધું ખોરવાઈ જાય. જેવી મનુષ્યજાતની વાણી, તેવી દુનિયા. વાણી તો પૃથ્વીની જિહ્વા છે. વાણીની શોભા એ જ દુનિયાની શોભા. માનવસમાજમાં જળવાતી મધુરતા કે કટુતાનો ઘણોખરો આધાર વાણી પર રહેલો છે. કબીર કહે છે :

**શબ્દ શબ્દ કા અંતરા, શબ્દ શબ્દ કા ભેદ;  
એક શબ્દ ઔષ્ણ કરે, એક શબ્દ કરે છેદ.**

રામ જ્યારે સુવર્ણમૃગને હણવા માટે દૂર જાય છે અને માયાવી મૃગ બનેલો મારીય, ‘હે લક્ષ્મણ, હે લક્ષ્મણ’ એવો આર્તનાદ કરે છે ત્યારે સીતા અત્યંત કડવાં વેણ સંભળાવીને લક્ષ્મણને કુટીર છોડીને જવાની ફરજ પાડે છે. થોડાક કડવા શબ્દો સીતાહરણના અને રામરાવણયુદ્ધના નિમિત્તરૂપ બની જાય છે. એ જ પ્રમાણે મયદાનવે રચેલા મહેલમાં દુર્યોધન પાણીમાં પડી જાય ત્યારે દ્રૌપદીએ સંભળાવેલાં વેણ દુર્યોધનના સ્વમાનને એવી ડેસ પહોંચાડે છે કે એનો ઘાયલ થયેલો અહંકાર મહાભારતના યુદ્ધ સુધી ઠરીને બેસતો નથી.

### વાણીનો સંયમ એટલે વાણીનું તપ

માલગાડીના વેગન પર બે સૂચનાઓ વાંચવા મળે છે :

(૧) સળગી ઉઠે તેવો માલ છે (હાઈલી ઈનફ્લેમેબલ).

(૨) શાંટિંગ વખતે છૂટું ન મૂકવું (નોટ ટુ બી લૂઝ શન્ટેડ).

ક્યારેક એવું લાગે છે કે આ બંને સૂચનાઓ મનુષ્યને મહાન વરદાનરૂપે મળેલી વાણીને આબાદ લાગુ પડે છે. વાણી આશીર્વાદ બની શકે અને અભિશાપ પણ બની શકે. પસંદગી મનુષ્યે કરવાની છે. અસ્તિત્વવાદી સાર્ત્ર કહે છે કે જીવન એટલે પસંદગી (ચોઈસ).

કપટી વાણી, કપટી કુટુંબ. જૂઠી વાણી, જૂઠો સમાજ. સાચી વાણી, નેક કમાણી. મધુર વાણી, મધુર માનવતા. નિર્મળ વાણી, નિર્મળ માનવસંબંધો.

સત્યમય વાણી, સ્વસ્થ માનવજાત.

સત્યમેવ જયતે । સત્ય એ જ પરમેશ્વર !

(‘પતંગિયાની અમૃતયાત્રા’માંથી સાભાર)

## ઉદ્યમો ભૈરવ:

શ્રી દિગંબર સ્વાદિયા



આઈ ઓફ લિવિંગના સંસ્થાપક પ.પુ. શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસો પહેલાં ‘સંસ્કાર’ ચેનલ ઉપર બોલતાં પોતાના કેનેડાના પ્રવાસનાં સંસ્મરણો રજૂ કરતાં સ્વાનુભવ પર આધારિત એક દાંત આપ્યું હતું.

એક દિવસ મોડી રાતે સાડા બારે તેઓનો જ્યાં ઉતારો હતો ત્યાં સાઠેક વર્ષની કોઈ મહિલાએ તેમને મળવાની ઈચ્છા દર્શાવી. ગુરુજીના અંતેવાસીઓએ આટલી મોડી રાતે તેમને જગાડવાની અનિયત દર્શાવી તો પણ ખી-હઠ આગળ તેઓ લાચાર બન્યા અને ગુરુજીને જાણ કરી. તેમણે એ મહિલાને આવવાનું પ્રયોજન પૂછ્યું. મહિલાએ કહ્યું : ‘હું બહુ દૂરથી ડ્રાઈવ કરીને ખાસ કામે આવી છું.’

‘બોલો મૈયા, શું કામ છે ?’ ગુરુજીએ પૂછ્યું.

‘મારે આ બસો ડોલર દાનમાં આપવા છે. બાળકોના કલ્યાણમાં એ રકમ વાપરજો.’

‘અરે, મૈયા, આટલા માટે તમે આટલો લાંબો પ્રવાસ જેડ્યો ? આ રકમ તો તમે સવારે પણ પહોંચાડી શક્યાં હોત...’ ગુરુજીએ સસ્પિટ જવાબ આપ્યો.

ના, ગુરુજી; મને અત્યારે જ દાન દેવાની ચાનક ચઢી અને મનનો શું ભરોસો ? તેનો ફેસલો બદલાઈ જાય એ પહેલાં જ મારે એ શુભ કાર્ય કરી લેવું હતું એમ કહીને તેણે એક દાંત કથા પણ સંભળાવી. ત્યાર પછી એ રકમ ગુરુજીને ચરણે ધરીને એ મહિલા વિદાય થઈ ગઈ.

એ ઉદાહરણ ઉપરથી તેમણે મન, બુદ્ધિ, હદ્ય, પ્રેમ વગેરેનો સૂક્ષ્મ ભેદ સમજાવતાં નારદ ભજિતસૂત્રનું ‘ઉદ્યમો ભૈરવો’ વિસ્તારથી સમજાવ્યું. તેમણે કહ્યું કે મન ચંચળ છે. તેને નિત નવું ગમે છે. મનને મર્કટ સાથે સરખાવવામાં આવે છે. ગંગાસીતીનું ભજન યાદ આવે છે ને ?

મેરુ તો ડા પણ જેનાં મન ના ડા રે, ભલે ભાંગી પડે રે ભરમાંડ રે...

હદ્યને જૂનું હોય એ પ્રિય છે. આપણા આપસના

સંબંધોય જો હદ્યપૂર્વકના હશે તો એ વર્ષોનાં વર્ષો સુધી જળવાયેલા રહે છે. એ માટે ઔપચારિક રીતે મળતા રહેવાની જરૂર રહેતી નથી. આપણે વર્ષો પછી નિકટના કોઈ સ્વજન કે મિત્રને મળીએ છીએ ત્યારે એ વર્ષોનું અંતર ઘડીના છંદ્ર ભાગમાં ઓસરી જાય છે. આપણે કહેવા લાગીએ છીએ કે ‘અરે, અમારો સંબંધ તો વર્ષો જૂનો છે.’ એવા સંબંધો પાછળ ભૌતિક કે આર્થિક એવો કોઈ પણ સ્વાર્થ સાધવાની ગણતરી હોતી નથી.

આથી ઊલટું, બુદ્ધિ આગળ-પાછળની તમામ ગણતરી કરીને જ આગળ ડગ માંડે છે. પોતાને કેટલો લાભ થશે, પોતે કેટલું ઘસાવું પડશે વગેરે લેખાંજોખાં બુદ્ધિ કરે છે. આવી ગણતરીપૂર્વકના સંબંધો સમયની એરણ ઉપર ખરા ઊતરતા નથી. જેને આપણે સાચા સંબંધો કહેતા હોઈએ એ સાચવવા પડતા નથી. અમુક સંજોગોમાં કોઈને માહું લાગશે કે કોઈ જાતની ગેરસમજ થશે એવા ડરથી જે સંબંધો સાચવવા પડતા હોય એ સંબંધો સાચા ગણાય જ નહિં.

આમ, મન અને બુદ્ધિનું સાંપ્રાજ્ય સીમિત હોય છે, જ્યારે હદ્યનાં સાંપ્રાજ્યનો વ્યાપ અસીમ હોય છે... પ્રેમ પણ એવી અસીમ અનુભૂતિનું જ બીજું નામ છે. એકબીજા પ્રત્યે આવો અતૂટ સંબંધ હોય તો અંતરમાં કડવાશ રહેતી જ નથી; એટલું જ નહિં, એવા સંબંધી જોડાયેલી વ્યક્તિઓ બિન હોવા છતાં અભિન રહે છે. અરસપરસ ઉપયોગી થવાની અને બીજા માટે મરી ફીટવાની તેઓની તૈયારી હોય છે.

આથી મનના આવેગો ઉપર લગામ રાખવી એ હિતાવહ છે. મનને જીતે તે સાચો વિજેતા કહેવાય. મનની આંટીઘૂંઠીઓ સમજવી, ઉકેલવી કે નાથવી એ કાચા-પોચા માનવીનું કામ નથી. એ માટે સાધના કરવી જરૂરી છે. એક વખત સાધનાની લગની લાગે પછી અન્ય કુલ્લક બાબતોમાં મન લલચાતું નથી, આથી આપણે હર શાસે એવી પ્રાર્થના કરીએ :

હમ કો મન કી શક્તિ દેના, મન વિજ્ય કરે;

દૂસરો કે જય સે પહેલો, ખુદ કો જય કરે...

## મહાકાલી



આધ્યાત્મની મા ભગવતીનાં ચાર સ્વરૂપો શ્રી અરવિંદ એમના ‘મા’ પુસ્તકમાં વર્ણિતાં છે. એમાં પ્રથમ છે : જ્ઞાન, વિશાળતા, માંગલ્ય, અક્ષયદયા. સમાટ સમી અલૌકિક મહિમા અને રાજાધિરાજના અપાર ગૌરવને ધારણ કરતી રાજરાજેશ્વરી મા મહેશ્વરી. બીજુ છે : ભવ્યતા, અમોઘ સામર્થ્ય, પ્રચંડ શક્તિ, દુર્દ્દ્રિય આવેગ, ક્ષાત્રભાવ, ઉત્ત્ર તપશક્તિ અને જગતને કંપાવનાર ભીષણ બળધારિણી મા મહાકાલી. મા ભગવતીનું ત્રીજું સ્વરૂપ માધુર્ય, સંવાદિતા, સમૃદ્ધિ, લાવજ્ય, મૂઢુતા અને મોહકતાને પ્રગટ કરે છે અને તે છે માતા મહાલક્ષ્મી. જ્યારે ચોથું સ્વરૂપ કાર્યમાં નિપુણતા, ચોકસાઈ, વસ્તુઓનું ઊંઠું જ્ઞાન, સૂક્ષ્મ સમજ, ધીરજ અને પૂર્ણતાને વ્યક્ત કરનાર મહાસરસ્વતીનું છે.

આ ચાર સ્વરૂપોમાં મહાકાલીનું સ્વરૂપ સૌથી વધારે ઉત્ત્ર અને રૈદ્ર છે. સૌભ્યતા નહીં પણ ઉત્ત્રતા, જ્ઞાન નહીં પણ શક્તિ, વિલંબિતતા નહીં પણ શીધતા. તત્કષણ પરિણામ અને ઝડપી સિદ્ધિ એ એનાં આગવાં લક્ષણો છે. માતા મહાકાલીનું નરમુંડ માલાધારી ભયાનક સ્વરૂપ વર્ણવામાં આવેલું છે, પણ એની ભયાનકતા પ્રભુવિરોધીઓ માટે છે, અસુરો માટે છે. અસત્યનું આચરણ કરનારાને રંજાડ કરનારા દૈયો માટે છે. શ્રી અરવિંદ મહાકાલી વિષે લખે છે કે, ‘તેનો કોપ વિરોધીઓને ભયંકર લાગે છે. દુર્બળ તથા ભીરુઓને એના દબાણની ભીષણતા આકરી લાગે છે, તો જેઓ મહાન છે, સમર્થ છે, ઉદાત્ત છે તેમને તે પ્રિય લાગે છે. તેઓ તેને ભજે છે.’

શ્રી અરવિંદ મહાકાલીનું સાચું સ્વરૂપ સુવર્ણરંગી છે તેમ જણાવે છે. એનું તેજ પ્રખર છે અને તે સ્વર્ણિમ છે. એનો કોપ અભિનિશખા જેવો છે. તે જેટલી ઉત્ત્ર છે તેથીય વધુ પ્રેમાળ છે અને એટલે જ તે પોતાનાં બાળકોની અંદર રહેલાં દૂષણો, વિકારોને સહી શકતી

નથી. આ બધાં દુષ્ટ સત્ત્વોને તે એક જાટકે કાપી નાખે છે અને શરણાગતોને તે સીધા આત્માના સંપર્કમાં મૂકી આપે છે. એ જરાસરખો પણ અન્યાય, અસત્ય કે અત્યાચાર સહન કરી શકતી નથી. જ્યારે જ્યારે તે અસત્યને જુએ છે, ત્યારે તે ઉત્ત્ર બની જાય છે ને અસત્યનાં પરિબળોને તે હણી નાખે છે. પ્રભુવિરોધી સત્ત્વોને તે મયક આપતી નથી. મનુષ્યની પ્રકૃતિમાં પણ એવાં હઠીલાં તત્ત્વો રહેલાં હોય છે કે જે સહેલાઈથી તેનો પીછો છોડતાં નથી ને ફરી ફરીને તેને હેરાન કર્યા કરે છે. આવાં ચીટકુ ને દુષ્ટ તત્ત્વોની પકડમાંથી મા મહાકાલી તેને એક જાટકે છોડાવી દે છે. ઉપરાંત માનવપ્રકૃતિની અંદર રહેલાં બળવાખોર સત્ત્વોને પણ તે ટીપી ટીપીને બહાર ફેંકી દે છે. આ તેનું વિશુદ્ધિ કાર્ય છે, પણ જ્યારે માનવની અંદર તેનું વિશુદ્ધિ કાર્ય ચાલતું હોય ત્યારે માનવમન કંપી ઉઠે છે ને તેની અંદર જ એક યુદ્ધ ચાલવા લાગે છે, ત્યારે માનવ એમ માને છે કે મહાકાલીનો પુણ્ય પ્રકોપ થયો. પણ વાસ્તવમાં તો એ પુણ્યપ્રકોપ નહીં પણ પોતાના બાળકને ઝડપથી શુદ્ધ બનાવવા ઈચ્છતી માનો અપાર પ્રેમ જ હોય છે, પરંતુ મનુષ્ય મહાકાલીના પ્રેમને સમજી શકતો નથી, કેમ કે મા ભગવતીનાં સર્વ સ્વરૂપોમાં તેના પ્રેમની અભિવ્યક્તિ નિરાળી છે. તેની પ્રસંગતા પ્રગટ કરવાની રીત અનોખી છે અને મનુષ્યોને તે ઉત્ત્ર લાગે છે એટલે જ મહાકાલીનું નામ પડતાં જ મનુષ્ય ભય અનુભવે છે. પણ વાસ્તવમાં મા ભગવતીનાં સર્વ સ્વરૂપોમાં મહાકાલી અત્યંત પ્રેમાળ અને માયાળું છે. ભગવાનજા રસ્તે જનાર બાળકનું સર્વ પ્રકારે રક્ષણ કરનાર મમતાળું માતા છે. શ્રી અરવિંદ કહે છે કે મહાકાલી સાધક પર આકમણ કરનાર શત્રુઓને કે જમા થયેલી મુશ્કેલીઓ અને બાધાઓને નિઃસત્ત્વ કરી દે છે. ખાલી ફોતરાં જેવાં

(અનુસંધાન પાન-૨૭ પર)

## શ્રી ચૈતન્ય મહાપ્રભુ - જીવન પ્રસંગો

શ્રી કનૈયાલાલ મ. પંડ્યા



### નિતાઈ

ગૌરાંગ શ્રી ચૈતન્ય મહાપ્રભુના મોટાભાઈ તરીકે પ્રસિદ્ધ નિતાઈ અથવા નિત્યાનંદનો જન્મ 'રાઢેશ'માં બ્રાહ્મણ કુળમાં થયો હતો. ગૌરભક્તો સંકીર્તનમાં ગૌર (મહાપ્રભુ)ના પહેલાં નિતાઈનું નામ બોલે છે :

**ભજો નિતાઈ ગૌર રાધેશ્યામ, જ્યો હરે કૃષ્ણ હરે રામ**

નિત્યાનંદના પિતાનું નામ 'હાડાઈ ઓજા' અને માતાનું નામ 'પચાવતી' હતું. નિત્યાનંદનું શરીર અત્યંત સુંદર અને લાવણ્યમય હતું, શરીર ગૌર હતું. તે બાલ્યકાળથી જ તીક્ષ્ણ બુદ્ધિમાન હતા. તેમણે નાની ઉંમરમાં જ સંસ્કૃત સાહિત્ય તથા વ્યાકરણનું ઉંઠું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું.

નિતાઈ અભ્યાસના સમય પછી બાળકો સાથે ખેલકૂદ કરતા. રમતમાં તે બાળકો સાથે શ્રીકૃષ્ણની લીલાઓનો અભિનય કરતા. કોઈ વાર ગોચારણ કરતા, તો કોઈ વાર પુલિન-ભોજનનો અભિનય કરતા. કોઈ વાર મથુરા-ગમનની લીલા બાળકો પાસે કરાવતા. તેમને લીલાઓનું જ્ઞાન કોની પાસેથી મળ્યું, તે કોઈ જાણતું નથી. તે બધી શાસ્ત્રીય લીલાઓ જ કરતા.

એક વાર રામાયણની લીલામાં તે લક્ષ્મણ-મૂર્ખનો અભિનય કરી રહ્યા હતા. તે મેઘનાદની શક્તિથી બેહોશ થઈને પડ્યા હતા. એક છોકરાને હનુમાન બનાવી સંજીવની બુટી લેવા મોકલવામાં આવ્યો. તે છોકરો ખૂબ નાનો હતો. તે તો અભિનય ભૂલી ગયો અને રમતમાં વળી ગયો, પરંતુ આ બેહોશ લક્ષ્મણ (નિતાઈ) તો સાચેસાચ બેહોશ થઈને પડ્યા હતા. લોકોએ જોયું કે તેમની નાડી ધીરે ધીરે ચાલી રહી છે. ઘણા જગાડવા છતાં ઉઠે જ નહિ. તેમના પિતાને બાળકોએ ખબર આપી. પિતા તો ઘણા દુઃખી થઈ ગયા.

એક બાળક રામનો અભિનય કરતો હતો. તે તેમની પાસે બેઠો હતો. તેને યાદ આવી ગયું કે તેણે

હનુમાન બનેવા બાળકને સંજીવની જડીબુટી લેવા મોકલ્યો છે. તેણે એ બાળકને બોલાવ્યો. તેની પાસે અભિનય કરાવી લક્ષ્મણને સંજીવની સુંધાડી ત્યારે તેની મૂર્ખ ભંગ થઈ. આ રીતે બાલ્યકાળથી તે જાત જાતની શાસ્ત્રીય લીલાઓનો અભિનય કરતા.

એક વાર એક સાધુ તેમને ઘેર આવ્યા. સાધુએ નિતાઈના પિતા 'હાડાઈ' પંડિતને કહ્યું : 'પ્રભો ! હું આપની પાસે એક બિક્ષા માણું છું, આપશો ?' હાડાઈ પંડિતે કહ્યું : 'પ્રભો ! મારી પાસે જે છે તેમાંથી હું ગમે તે ચીજ તમને આપીશ, શરીર પણ આપવા તૈયાર છું.'

સંન્યાસીએ કહ્યું : 'હું તમારું શરીર માગતો નથી, તમારા પ્રાણ માગતો નથી, પરંતુ બહારના પ્રાણોની યાચના કરું છું. તમે તમારા પ્રાણોથી પણ પ્રિય જ્યેષ પુત્ર નિતાઈ મને આપો. હું સર્વ તીર્થોની યાત્રા કરવા હશ્યું છું. તે માટે મારે એક સાથીની જરૂર છે. તમારો આ પુત્ર યોગ્ય અને હોશિયાર છે. તેનું પણ કલ્યાણ થશે અને મારું કામ થઈ જશે.'

માતાપિતાએ પરસ્પર ચર્ચા કરી. આ અત્યંત દુઃખની ઘડી હતી, પરંતુ નિત્યાનંદને તેમાં કોઈ વિરોધ ન હતો. માતાપિતાએ ઘણા જ દુઃખ સાથે સંમતિ આપી ત્યારે નિતાઈ પ્રસંગતાપૂર્વક સંન્યાસી સાથે ચાલી નીકળ્યા. પાછા ફરીને પણ જોયું નહિ. વૈરાગ્યનું કેવું જવલંત દિશાંત ! સંન્યાસી સાથે નિત્યાનંદજીએ ભારતવર્ષનાં પ્રાય: બધાં મુખ્ય તીર્થોની યાત્રા કરી.

મથુરા, દ્વારકા, બદરીનારાયણ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, રંગનાથ, સેતુબંધ રામેશ્વર, જગશાથપુરી વગેરે તીર્થોમાં ગયા. તીર્થયાત્રા દરમિયાન તેમને ચૈતન્ય મહાપ્રભુના ગુરુ શ્રી માધવેન્દ્રપુરીનો સાક્ષાત્કાર થયો, જેમના દ્વારા તેમને શ્રીકૃષ્ણભક્તિ મ્રાપ્ત થતાં તે પ્રેમમાં વિઝ્વવળ થઈ ગયા. તેમની વિદ્યાય લઈને તે પ્રજમાં આવ્યા ત્યારે તેમને લઈને તીર્થયાત્રાએ નીકળ્યા હતા તે સંન્યાસી

અદ્યથ થઈ ગયા, તેની તેમને ખબર જ ન પડી.

પ્રજમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે નવદીપ (બંગાળા)માં ભગવાન સ્વયં ગૌરાંગ શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા છે, જે નિરંતર મોહજવાળામાં બળતા સંસારીઓને શ્રીકૃષ્ણ-સંકીર્તનરૂપી અમૃતથી શીતળતા પ્રદાન કરી રહ્યા છે. નિતાઈ પ્રજમાં ન રહી શક્યા. તે પ્રયાગ અને કાશી થઈને સીધા નવદીપમાં જઈ પહોંચ્યા. નવદીપમાં થઈ નિત્યાનંદ પંડિત નન્દનાચાર્યને ઘેર રહ્યા. આ બાજુ મહાપ્રભુજીએ પોતાની દિવ્ય દિલ્લી દ્વારા તેમની યોગ્ય નિશાની આપી ભક્તોને મોકલ્યા અને તેમને પોતાની પાસે બોલાવી લીધા. આ પહેલાં મહાપ્રભુના મોટાભાઈ ‘વિશ્વરૂપ’ સંન્યાસ લઈને ચાલ્યા ગયા હતા. તેમના વિરહમાં જૂરતાં શચીમાતાને પ્રભુએ કહ્યું : ‘મા ! આ તારો વિશ્વરૂપ જ છે’ એમ કહી નિત્યાનંદને પોતાને ઘેર રાખ્યા અને શચીમાતાએ તેમનું પુત્રવત્ર પાલન કર્યું. નિત્યાનંદને મન તો મહાપ્રભુ સાક્ષાત્ શ્રીકૃષ્ણ હતા, તેથી તેમનો તેમના પ્રત્યેનો પ્રેમ અસીમ હતો. નિત્યાનંદજી અવધૂત હતા. તેમણે મહાપ્રભુના પડછાયાની માફક રહીને શ્રીકૃષ્ણ-કીર્તનનો ધંડો જ પ્રચાર કર્યો હતો.

(‘ભગવદ્ગીતાનું દિવ્ય જીવનરહસ્ય અને શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જીવન અને તત્ત્વદર્શન’માંથી ઉદ્ધૂત)

(મહાકાલી - અનુસંધાન પાના નં. ૨૫ પરનું)

કરીને તે એક ક્ષણમાં વિખેરી નાખે છે. તોડીકોડી નાખે છે, એથી જ જે કાર્યને સૈકાઓ લાગે છે, તે કાર્યને મહાકાલી એક જ દિવસમાં કરી નાખે છે.

મહાકાલીની કૃપાથી જ શ્રીરામકૃષ્ણે અત્ય સમયમાં બધી જ સાધનાઓ સિદ્ધ કરી હતી. દક્ષિણોશરના કાલી મંદિરની મા કાલીની પ્રતિમા એ તેમને માટે સાક્ષાત્ મા જગંબા હતી. તેઓ મા પાસેથી જ સધણું માર્ગદર્શન મેળવતા હતા. મા કાલીને તેમણે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું હતું, તો માએ તેમના જીવનની સંપૂર્ણ જીવાબદારી વહન કરી હતી. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તંત્ર, બ્રહ્મ - અદ્વૈતવેદાંત - આ સધણા પ્રકારની યોગસાધનાઓની સિદ્ધ માની કૃપાને પરિણામે તેઓ મેળવી શક્યા હતા. મહાકાલી માતા પોતાના આશ્રયે આવેલા બાળકને ખૂબ ઝડપથી ભગવાનની પાસે લઈ જાય છે અને એ જ તો પ્રભુએ એને સોંપેલું કાર્ય છે કે પ્રભુવિરોધીઓનો વિનાશ કરી પ્રભુમય જગતની રચના કરવી.

આવો, આજે કાળી ચૌદશના સુપ્રભાતે મા મહાકાલીને પ્રાર્થના કરીએ કે આપણી પ્રકૃતિમાં રહેલાં અજ્ઞાન અને અંધકારનાં બળોને દૂર કરીને આપણને પ્રભુની સમીપ લઈ જાય.

## યોગશિક્ષક તાલીમ શિબિર

શિવાનંદ આશ્રમ, જોધપુર ટેકરા, અમદાવાદ ખાતે તા. ૧૧ ડિસેમ્બરથી ઉઠોનું ડિસેમ્બર, ૨૦૦૭ સુધી સંપૂર્ણ આવાસીય યોગશિક્ષક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. યોગનું પ્રારંભિક જ્ઞાન ધરાવતા અને નિયમિત અભ્યાસ કરતા રૂપ વર્ષથી વધુ ઉંમરના સ્નાતકો માટે ગુજરાત યુનિવર્સિટી માન્ય આ સર્ટિફિકેટ કોર્સમાં યોગાસનો, પ્રાણાયામ, મુદ્રા, બંધ ઉપરાંત શરીર વિજ્ઞાન, પાતંજલ યોગદર્શન વિષયોના નિષ્ણાત તજ્જ્ઞો દ્વારા શિખવવામાં આવશે. અભ્યાસકર્મની લેખિત, મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉત્તીર્ણ થનારને સર્ટિફિકેટ આપવામાં આવે છે. વધુ માહિતી માટે શિવાનંદ આશ્રમ, અમદાવાદ, ફોન નં. ૦૭૯-૨૬૮૬૧૨૩૪, ૨૩૪૫ સંપર્ક કરવો અથવા [www.divyajivan.org](http://www.divyajivan.org) ઉપર વધુ માહિતી મળી શકશે.

-શિવાનંદ આશ્રમ, અમદાવાદ

## પ્રત્યેક દિવસ, એક નવી શરૂઆત

ડૉ. હરીશ દ્વિવેદી

એક સુંદર અંગેજ કવિતા છે :

Every day is fresh beginning  
Every morn is the world made new,  
You who are weary of sorrow and sinning.  
Here is a beautiful hope for you,  
A hope for one and a hope for you.

કવિતા ઘણી લાંબી છે. જેનો ભાવાનુવાદ આ પ્રમાણે છે :

પ્રતિદિન થતી હોય છે સૂર્યોદયની સાથે જિંદગીની એક નવી શરૂઆત. જીવનનો એક નવો આરંભ. જીવનના એક નવા અધ્યાયનો ઉગમણી દિશાએથી નિતનવું નજરાણું લઈને વિવિધ રંગઘટાઓ સાથે થતું પ્રભાતનું શુભાગમન આશાના તેજદિરણને પ્રગતાવી દુઃખી સંતપ્ત નિરાશામય બની ગયેલ જીવનને આશાની સંજીવનીથી બસ્તે છે રોજેરોજ એક નવું જીવન.

ભૂતકાળ તો સરી જતો હોય છે મહાકાળની એ ગતિમાં જ્યાંથી કદી પાછો એ ફરી શકતો નથી. જે વીતી ગયું છે તેને બદલી શકતું હોતું નથી. તો પછી એનો સંતાપ શાને ? સખત પરિશ્રમ ને આંસુઓનો એ હતો ઈતિહાસ કરી હતી ભૂલો જે કંઈ તે બધી બેઠી છે ભૂતાવળ થઈને, વજઘાત સમા ભૂતકાળનાં એ કારમા જખમો આમ તો રુજ્ઝાઈ ગયા છે આજે અને એમાંથી જ પ્રગટ્યું છે મારામાં આ ગજબનાક શક્તિનું પ્રચંડ સામર્થ્ય !

એ બધી ભૂતકાળની વાતોની સાથે તું કદી ઘસડાઈ જઈશ. મા, જે બની ગયું છે તેને ઈશ્વરની માફક કર્તુભૂ અકર્તુભૂ અન્યથા કર્તુભૂ કરવાની નથી તાકાત કોઈ આપણો પાસે. વીતી ગયેલ ક્ષાળ નથી સરભર કરી શકતી કદી. એ બધું સામર્થ્ય ભર્યું છે કેવળ પ્રભુની અનંત કૃપામાં. ત્યાં બધું જ શક્ય છે જ્યાં હોય છે સ્પર્શ પ્રભુનો. આપણું પાથેય છે રોજેરોજ ઉગતો દિવસ. એમાં પણ આપણો કહી શકાય એ છે માત્ર આજનો દિવસ અને હાથમાં રહેતી વર્તમાનની આ એક ક્ષાળ !

પ્રત્યેક દિવસ બની શકે છે એક નવી શરૂઆત જિંદગીની. આશ્વસ્ત થઈને સાંભળ મારા પ્રિય આત્મનું !

ભૂતકાળના દુઃખદંડ અને સંતાપોની વણથંભી વણજારને યાદ કરી ગભરાઈશ નહીં અને આવી પડનાર વિંબણાઓની ભવિષ્યવાણી પણ કેટલી સાચી પડતી હોય છે ? વિચારી શકીએ એ બધાં દુઃખો વિચારવા બેસીએ તો એનો નથી કોઈ આરો કે નથી ઓવારો ! તારા માટે ઊર્ધ્વાં છે આ નવલું પ્રભાત. આશાને ઉત્સાહ સાથે કર જિંદગીની નવી શરૂઆત આજે. પ્રત્યેક દિવસ હોય છે, જિંદગીની નવી શરૂઆત કાજે.

કોઈ તત્ત્વચિંતકે સાચું જ કહ્યું છે કે, પ્રત્યેક દિવસ એ શાશ્વતીની નાનકડી પ્રતિકૃતિ સમાન હોય છે. સનાતન શાશ્વત તત્ત્વ કેવું હોય છે એ તો આપણે જાણતાં નથી, પરંતુ હા, રોજ સવારે પૂર્વ દિશાએથી ઉગતા પ્રભાતની સાથે નવા જીવનની શરૂઆત થતી હોય છે. સૂર્યોદય પહેલાંનું કેવું આહ્લાદમય એ વાતાવરણ હોય છે. નવલાં પ્રભાતના વધામણાં માટે ઉષાદેવી આકાશના આંગણો જાણે રંગોના સાચિયા પૂરી સ્વાગતની તૈયારીઓ કરી દેતી હોય છે. મંદ મંદ વહેતા શીતળ પવન અને પંખીઓનાં મીઠાં મધુરાં ગાન સાથે આકાશમાં ઉડાન મનને પ્રફુલ્લિત કરી દેતાં હોય છે.

પરંતુ આ બધું જોવાનો કે સાંભળવાનો સમય જ ક્યાં છે આપણી પાસે ? આપણે તો એકવીસમી સદીમાં તીવ્ર રોકેટ ગતિએ બસ આગળ ને આગળ વગર વિચારે દોડતાં જઈએ છીએ. ભવિષ્યના સોનેરી સ્વનભમાં આપણે ખોવાઈ જતાં હોઈએ છીએ. શેખચલ્લી જેવા એ વિચારોમાં હાથમાં રહેલી વર્તમાનની અનમોલ ક્ષાળને સાવ વર્થમાં જ ગુમાવી દેતાં હોઈએ છીએ. વાસ્તવમાં આપણી પાસે જે કંઈ છે તે આજની હાથમાં રહેલી વર્તમાનની ક્ષાળ છે. આપણે જે કંઈ કરવાનું છે તેને માટે આજની વર્તમાનની ક્ષાળ છે. અને આજની વર્તમાનની ક્ષાળ એ જ સર્વોત્તમ ઘડી છે, સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે. આ વર્તમાનની ક્ષાળને આપણે જીવી જ્ઞાનતાં શીખવું પડશે.

આ દુનિયામાં આધિ, વ્યાધિ, ઉપાધિ અને દુઃખદંડનો તો કોઈ પાર નથી. સહુ કોઈને પોતાનું દુઃખ વધુ લાગતું હોય છે. પરંતુ દુનિયાનાં બધાં જ દુઃખોને

ભેગાં કરીને દુઃખના ઉંગરને જો સરખા ભાગે વહેંચી લેવાનું કહેવામાં આવે તો પછી એને લેવા કોઈ તૈયાર થાય નહીં. બધા પોતપોતાની દુઃખની પોટલી ઉપાડી ચાલવા માંડે ! તથાગત ભગવાન બુદ્ધે આવી પરિસ્થિતિ જોઈને જ “સત્ય દુઃખ દુઃખ” એવી ઉદ્ઘોષણા કરી હતી. એનો સ્વીકાર કરીએ એમાં કશો જ વાંધો નથી. પરંતુ એમાં હવે આપણે સહેજ પણ વધારો કરવો નથી અને એનાથી દુઃખી પણ થવું નથી.

પરંતુ આપણી દશા તો બિરબલે કહેલા પેલા મૂર્ખશિરોમણિના જેવી હોય છે. જે સહુ પ્રથમ તો દુઃખ આવવાનું છે એની ભાવિ કલ્પના કરી એને વિશે વિચારી વિચારીને દુઃખી થતો હોય છે, ત્યાર બાદ વાસ્તવમાં ખરેખર જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે એને સહન કરીને એ દુઃખ ભોગવતો હોય છે અને છેવટે દુઃખ દૂર થઈ ગયા પછી પણ વારંવાર એને યાદ કરીને એ દુઃખી થતો હોય છે. આ રીતે મૂર્ખશિરોમણિ ત્રણ વખત દુઃખી થતો હોય છે. આપણે કેટલી વાર દુઃખી થવું, એ આપણે જ નક્કી કરવાનું છે.

ભવિષ્યમાં દુઃખ આવવાનું છે એવી કલ્પના કરી દુઃખી થવાનો કોઈ અર્થ નથી, કારણ કે ભવિષ્યની ક્ષણે શું આવવાનું છે તે આપણે જાણતા નથી અને એના ઉપર આપણું કોઈ નિયંત્રણ પણ હોતું નથી તો પછી દુઃખી શાને થવું ? અને વીતી ગયેલી ક્ષણો તો ભૂતકાળમાં સરી જતી હોય છે એને આપણે બદલી શકીએ તેમ નથી તો પછી દુઃખ સંતાપની એ ક્ષણોની દુઃખદ સ્મૃતિઓને વાગોળીને દુઃખી થવાનો પણ શો અર્થ ? આંસુઓના એ ઈતિહાસને અને સ્મૃતિઓની એ ભૂતાવળને ભૂતકાળમાં ફ્લૂરી દઈએ એ જ યોગ્ય છે. એને યાદ કરી વારંવાર દુઃખી થવું એનાથી મોટી મૂર્ખભી બીજી કર્દ હોઈ શકે ? ભૂતકાળને આપણે ભૂતકાળ જ રહેવા દઈએ એમાં જ એનું ગૌરવ છે. એના અનુભવોમાંથી જે શાશપણ આપણને લાધ્યું છે, જે સામર્થ્ય અને શક્તિ પ્રગટ્યાં છે, એને લઈને આપણે આગળ વધીએ.

આપણી પાસે આવનાર દિવસોનો અમૂલ્ય ખજનો ખુલ્લો પડ્યો છે. એમાં પણ આજનો દિવસ અને વર્તમાનની ક્ષણ તો અમૂલ્ય છે. પ્રત્યેક પ્રભાત એ જીવનની નવી શરૂઆત છે. દુઃખ સંતાપ, નિરાશા અને અણધારી આવી

પડતી વિપત્તિઓની વણથંભી વણજાર ક્યારેક આપણને મુંજવી પણ નાખતી હોય છે. એવા અભાવાત્મક વિચારોના વિષયકમાં ફસાઈ જઈએ એ પહેલાં જ એને આવતું જોઈ દૂરથી નવ ગજના નમસ્કાર કરતાં શીખવું પડશે. એ બધાને ખૂબ સારી રીતે આપણે ઓળખી લીધાં છે. એમને લીધે આવતાં માઠાં પરિણામો પણ આપણે અનુભવી લીધાં હોય છે. એમ છતાં કોણ જાણે કેમ માણસ સામે ચઢીને દુઃખને આમંત્રણ આપતો હોય છે. જેને આપણે ‘Love of Suffering’ આત્મપીડન કહીએ છીએ એ એને ગમતું હોય છે. પરિણામે પોતે તો દુઃખી થાય છે અને બીજાઓને પણ એ દુઃખી કરે છે.

વાસ્તવમાં સુખી થવું એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણા એ આનંદમય સ્વરૂપને આપણે સાવ ભૂલી ગયા છીએ એટલે જ આટલાં દીન, દુઃખી, બાપડાં-બિચારાં બની દેવદાસની જેમ મોહું લટકાવી ફરતા હોઈએ છીએ, પરંતુ ક્યાં સુધી આવી રીતે ફરતા રહીશું ? આશા અને ઉત્સાહનું નવું નજરાણું લઈને આવતી આ ક્ષણ આપણું સ્વાગત કરવા સામે આવીને ઊભી છે. જીવનની એ એક નવી શરૂઆત છે. જિંદગીને એક નવા દાણિબિંદુથી જોતાં આપણો શીખવાનું છે. પછી એની સમક્ષ દુઃખ ચિંતા નિરાશા ઊભાં રહી શકશો જ નહીં. ખરેખર તો એ બધા અભાવોનું કોઈ અસ્તિત્વ જ હોતું નથી.

આ સંદર્ભમાં મહાત્મા નિકોલે કહ્યું છે તે પ્રમાણે ‘આવતી કાલનો કદી વિશ્વાસ કરશો નહીં. ‘આવતી કાલે’ માણસજ્ઞતનું ધણું આહિત કર્યું છે.’ આપણી પાસે જે કંઈ છે તે હાથમાં રહેલી વર્તમાનની આ ક્ષણ છે. એના ઉપર આપણો પૂરેપૂરો અધિકાર છે. માત્ર આપણે પસંદગી કરવાની છે અને એની પણ પૂરેપૂરી સ્વતંત્રતા આપણને આપવામાં આવી છે તો પછી હાથે કરીને દુઃખી થવાની જરૂર શી છે ? અત્યાર સુધી ખૂબ સારી રીતે આપણે દુઃખી થયા છીએ. કોઈ કારણ ના હોય તો નાનું અમથું કારણ શોધી કાઢીને પણ પોતે તો દુઃખી થયા જ છીએ સાથે બીજાને પણ દુઃખી કર્યા છે.

બસ, હવે ફરીથી ક્યારેય દુઃખી થવું નથી એવો શુભ સંકલ્પ કરીએ. હાથમાં રહેલી વર્તમાનની ક્ષણને ખૂબ પ્રેમ અને ઉત્સાહથી જીવની દર્શાવી દઈએ અને પ્રત્યેક દિવસે જીવનની એક નવી શરૂઆત કરીએ !



**દિવ્ય જીવન સાંસ્કૃતિક સંદ્ય, અમદાવાદ :** શ્રી સદ્ગુરુ દેવ સ્વામી શિવાનંદજી મહારાજના આ પવિત્ર આશ્રમના પ્રાણિઓમાં ફલરમો યોગસન, પ્રાણાયામ, ધ્યાન શિબિર તા. ૧લી ઓક્ટોબરથી દસમી ઓક્ટોબર સુધી આયોજાયો. ૮૮૭ મુમુક્ષુઓ આ યોગસત્રમાં જોડાયા. સુપ્રસિદ્ધ કાર્ડિયોલોડિસ્ટ ડૉ. તેજસ પટેલે દીપ પ્રજ્વલન કરીને યોગસત્રનો શુભારંભ કરાવ્યો. તેઓ પોતે યોગના પ્રમાણિક અભ્યાસી છે. દરરોજ એક કલાક સુધી કપાલભાતિ કિયા (પ્રાણાયામ) કરે છે. તેમણે કહ્યું, ‘યોગનો અભ્યાસ સુખદ સ્વાસ્થ્ય અને નીરોગી જીવન બક્ષે છે, પરંતુ માત્ર યોગથી જ રોગનિવારણ થાય તેમ માનવું ન જોઈએ. યોગઅભ્યાસ સાથે ઉચિત મેડિલ સારવાર અને યોગ્ય આહારની પણ કણજી લેવી જોઈએ.’ ૮મી ઓક્ટોબરે ૧૦૧ યોગપ્રેમોઓએ મહાશંખ પ્રકાલન, કૂજલકિયા, જલનેતીકિયા કરી. તેનું સફળ સંચાલન શ્રી તપન મંકોરીના નિર્દેશનમાં થયું.

પૂર્ણાંહુતિ પ્રસંગે ડૉ. મયૂર પટેલ (સુપ્રસિદ્ધ ડાયાબિટોલોજિસ્ટ) અને શ્રીમતી ડૉ. ઈના પટેલે પ્રેરણા આપી. સમગ્ર યોગ શિબિર આશ્રમના યોગશિક્ષકો, ભક્તોના ઉત્સાહ સાથે સંપત્ત થયો.

બીજી ઓક્ટોબરે સવારે ૮-૩૦ વાગ્યે પૂજ્ય બાપુજી મહાત્મા ગાંધીજીના પવિત્ર સાબરમતી આશ્રમમાં સર્વર્ધમ પ્રાર્થનામાં વેદમંત્રોથી પ્રાર્થનાનો શુભારંભ પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજે કરાવ્યો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી પંડિત નવલકિશોર શર્માજી પણ ઉપસ્થિત રહ્યા.

અમદાવાદ સ્થુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ રોટરી કલબો દ્વારા અમદાવાદની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ હરીકાઈ આયોજવામાં આવી, જેમાં હજારો બાળકોએ ભાગ લીધો. તેના ફાઈનલ વક્તાઓના વક્તૃત્વનો સમારંભ પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજીના પ્રમુખપદે ઓક્ટોબરની ૪થી તારીખે ટાગોર હોલમાં આયોજાયો. સેમિફાઇનલમાં આવેલી ઊર શાળાઓને શિવાનંદ આશ્રમ તરફથી યોગના પાઠો (૨૬ પુસ્તકો)ના સેટ બેટ આપવામાં આવ્યા.

સવારે ૧૦-૩૦ વાગ્યે શહેરના સુપ્રસિદ્ધ ટાગોર હોલમાં પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજશ્રીના પ્રમુખપદે અમદાવાદના રક્તદાતાઓની વિશેષ ક્ષમતાઓનું ગૌરવપ્રદ સન્માન કરવામાં આવ્યું. અમદાવાદમાં પાંચ હજારથી વધુ પરિવારો નિયમિત રક્તદાન કરે છે. અગણિત સંસ્થાઓ નિયમિત રક્તદાન શિબિરો યોજે છે. અનેક વિકલાંગો સો

વારથી વધુ રક્તદાન કરી ચૂક્યા છે. પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજશ્રીએ પણ ૧૧૭ વખત રક્તદાન કરેલું છે. અમદાવાદ રેડકોસ સોસાયટીના પ્રમુખશ્રીએ કહ્યું, ‘કદાચ વિશ્વમાં ગેરુ વખતમાં આ એક જ સંત હશે કે જેમણે આવું વિરલ રક્તદાન કર્યું હશે અને સતત રક્તદાન શિબિરોના સ્વામીજી આયોજક તથા પ્રેરક રહ્યા છે. સ્વામીજીનાં પુસ્તકોમાંથી મળતી હજારો રૂપિયાની રોયલ્ટી પણ પૂજ્ય સ્વામીજી બાળકોના બ્લડ થેલીસીમિયા પ્રોજેક્ટની સેવાર્થે આપે છે. આ પ્રસંગે જાણીતા ગજલ ગાયક બંધુઓ પંકજ ઉધાસ અને મનહર ઉધાસ તથા ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ શ્રીમતી દિવેટિયા પણ હાજર રહ્યાં હતાં. શ્રી પંકજ ઉધાસ છેલ્લાં ૧૬ વર્ષથી મુંબઈની બાળકોના બ્લડ થેલીસીમિયા સેવા સંકુલના અધ્યક્ષ છે. સુપ્રસિદ્ધ ગજલ ગાયકોનો દર વર્ષે એક જાહેર કાર્યક્રમ આ સેવાર્થ-લાભાર્થે આયોજે છે. આ પ્રસંગે સતત ચાર કલાક સુધી અગણિત રક્તદાતાઓનું સન્માન થયું.

ચોથી ઓક્ટોબરે સવારે ૮-૩૦ થી બપોરે ૧-૩૦ વાગ્યા સુધી રોટરી કલબ મહિનગર દ્વારા લા ગજજર હોલ જાતે અમદાવાદના સુપ્રસિદ્ધ ડોક્ટરોનાં પ્રવચનોનો કાર્યક્રમ આયોજયો હતો. સૌ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હતા. સમગ્ર કાર્યક્રમ શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજના અધ્યક્ષપદે આયોજયો. પૂજ્ય સ્વામીજીએ પોતાના વક્તવ્યમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે ‘માનસિક સ્વાસ્થ્ય’ વિચાર, વાણી અને વ્યવહારમાંથી ખોરવાતા વિવેક અને શીલ તથા ‘ઉકીરેમ’ના ડ્રાસ સામે દુઃખ વ્યક્ત કર્યું હતું. તદર્થે પ્રાણાયામ, ધ્યાન, સદ્ગુરુંચન, સદ્ગુરીંચન, સત્સંગની હિમાયત કરી હતી.

છીઢી ઓક્ટોબરની રાત્રે ટાગોર હોલમાં ‘અમૃતમ્’ સંસ્થાનો વાર્ષિકોત્સવ પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજના પ્રમુખપદે અને સોલા ભાગવત વિદ્યાપીઠના ભાગવતાચાર્ય શ્રી ભાગવતજીના અતિથિવિરોધપદે આયોજયો. આ પ્રસંગે શ્રીમતી ડૉ. ઉમા અનેતાનીના નિર્દેશનમાં અને ડૉ. મોનિકાબહેનના કંઠે પ્રસ્તુત વૈદિક વાક્યમય પુરુષસૂક્તમ્, શ્રીદીવી સૂક્તમ્ અને તૈતીરિય પ્રશ્નના મંત્રો ઉપર અદ્ભુત ભારતનાટ્યમ નૃત્ય અભિનય પ્રસ્તુત કરવામાં આવ્યો.

મહામંડલેશ્વર શ્રીમત્ર સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજના પ્રમુખપદે સ્થાપિત સંસ્થા મારુતિધામનો પ્રથમ વાર્ષિકોત્સવ પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને અને ઉદ્ભોધન સાથે સાતમી તારીખે ધામધૂમથી ઊજવાયો.

બારમી ઓક્ટોબરથી એકવીસમી ઓક્ટોબર સુધી આશ્રમનાં શ્રીશ્રીશ્રી અષ્ટલક્ષ્મી ભવનમાં નવરાત્રી ઉત્સવ ખૂબ

જ ધામધૂમથી ઉજવવામાં આવ્યું. શ્રીશ્રી ભવનમાં પવિત્ર ઘટસ્થાપન કરવામાં આવ્યું. દરરોજ સવારે ૮-૩૦થી ૧૨-૦૦ વાગ્યા સુધી શ્રીમત્ ભગવદ્ગીતાના અધારેય અધ્યાય અને ધ્યાન શ્લોક તથા માહાત્મ્યનું સસ્વર પાઠ-પારાયણ કરવામાં આવ્યું. તે જ પ્રમાણે દરરોજ બપોરે ૪-૦૦ વાગ્યાથી સાંજે ૭-૩૦ વાગ્યા સુધી દરરોજ સમગ્ર ચંડીપાઠનું સસ્વર પારાયણ કરવામાં આવ્યું. અષ્ટમીનો પવિત્ર હવન અને કુમારિકા પૂજનમાં ૧૮૦ કુમારિકાઓ-બટકનું વૈદિક પૂજન થયું તથા સૌને શ્રીશ્રીમાનો ખીર-પૂરી-ચણાનો મહાપ્રાસાદ પીરસવામાં આવ્યો. દરેરા સુધી રાત્રે આશ્રમનું પ્રાંગણ ગરબાની રમ્યાટથી ગાજતું-ગુજતું થયું. સેંકડો ભક્ત ભાઈ-બહેનો ઢોલીડાને તાલે ખૂબ ઝૂયાં. શ્રીમતી રૂપાબહેન તથા શ્રી મનીષ મજમુદારના કંઠે અને શ્રી જિતુભાઈ પટેલની વ્યવસ્થાએ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ તથા ઉમંગ સાથે પરિપૂર્ણ થયો. આ પ્રસંગે અનેક ભક્તો તરફથી વિવિધ પ્રસાદનું ઉદારતાથી વિતરણ કરવામાં આવ્યું.

તા.૧૭ના રોજ દક્ષિણ ભારતીય સમાજના નવચેંડી હોમમ્સ અને શ્રી કુમારીકાપૂજન મહોત્સવે પૂજય સ્વામીજનું બહુમાન કરવામાં આવ્યું.

તા.૨૧મીને દરેરાના દિવસે શ્રીશ્રી અષ્ટલક્ષ્મી ભવનમાં ભવ્ય વિદ્યારંભણમ્ય કાર્યક્રમ વૈદિક અને સર્વે શાસ્કોના મંત્રપાઠથી થયો. બપોરે ‘આરથા મ્યુચ્યુઅલ ફંડ’ સંસ્થાનું ઉદ્ઘાટન પૂજય સ્વામીજાને કર્યું.

તા.૨૨મીની રાત્રે સમસ્ત નાગર મંડળના ગરબાનો ભવ્ય કાર્યક્રમ આશ્રમના પ્રાંગણમાં થયો.

તા.૨૪મીના રોજ ચિન્મય મિશન, ચેમર્ના ૧૪૦ ભક્તો આશ્રમમાં આવીને રહ્યા.

તા.૨૫મીના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન આયોજિત ૧૫મા મેનેજમેન્ટ વીકમાં પૂજય સ્વામી અધ્યાત્માનંદજીનું વક્તવ્ય આયોજાયું. આ વર્ષે આ જ્ઞાનયજ્ઞમાં ચેમરીથી સ્વામી શુદ્ધાનંદજી, કોઈભતુરથી શ્રીમતી સ્વામી દ્યાનંદજી મહારાજ, બાપ્સ સંસ્થાના શ્રી બ્રહ્મવિહારીદાસજી, સ્વામી અધ્યાત્માનંદજી મહારાજશ્રી તથા શ્રી સ્વામી અજુભવાનંદજી મહારાજ (મુંબઈ)નાં મનનીય ઉદ્ભોધનો થયાં.

શરદપૂર્ણિમાની રાત્રે ૨૬મી તારીખે ગુજરાત ટાઈમ્સ, અમદાવાદ NRI સિનિયર સિટીઝન તથા શિવાનંદ આશ્રમના પરસ્પર સહયોગથી આશ્રમના પ્રાંગણમાં ગરબા થયા.

સમગ્ર મહિનો ખૂબ જ ધામધૂમ આનંદપૂર્વક ભક્તિસભર આનંદમાં સંપત્ત થયો. આ મહિનાનું વિશેષ આકર્ષણ તા.પહેલીથી દસમી ઓક્ટોબર સુધી જ્ઞાનગર શ્રીમદ્ ભગવદ્ગીતા યુનિવર્સિટી અને સાધના મંદિર ગીતા વિદ્યાલયના સંસ્થાપક ગીતાચાર્ય શ્રી કિશોરભાઈ દવેના ગીતા અષ્ટાદશાહી-ગીતાજના અધારેય અધ્યાયના પ્રવચનોનો રહ્યો. તદુપરાંત

ડૉ. સ્નેહલ અમિત સાહેબના યોગ દ્વારા રોગનિવારણની સેવા, મહા હવનાષ્મી-અષ્ટમીના રોજ તથા દરેરાના રોજ દરિદ્રનારાયણની સેવા, નિયમિત યોગવર્ગો તથા નિયમિત અનાજ વિતરણ વગેરે કાર્યક્રમો થયા.

સર્વે પ્રસંગોએ દિલ્હી, અંબાલા, હથીકેશ, ગંગોત્રી, જીમનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, વલસાડ, વડોદરાથી ભક્તોની ઉત્સાહભરી હાજરીથી આશ્રમ આંગણ મુખરિત થયું.

**ઉત્સાહનું શાખા :** શ્રીમતી જયશ્રીબહેન પી. ટાકરે શુરૂપાદ્યકા પૂજા કરાવી, પાંચ સભ્યોએ પૂજા કરી. તા. ૧૪-૧૦-૦૭ના રોજ ઉત્સાહનું બગીચાના સિનિયર સિટીઝનોને પ્રીતિભોજન અને એક્સ્યુપ્રેશર મશીનનું નિર્દેશન કરાયું. શ્રી ખુશાલદાસ જે. મકવાણા સ્વાતંત્ર્યસેનાનીના હાથે ઉદ્ઘાટન થયું તથા ભોજનનો ખર્ચ પણ તેઓશ્રીએ આપ્યો. દરરોજ સવારે એક્સ્યુપ્રેશરના મશીન ઉપર ચારથી પાંચ સભ્યો લાભ લે છે અને દરેકને ફાયદો થાય છે. નવરાત્રી દરમ્યાન અમારા ટ્રેઝરર શ્રી પ્રદ્યુમ્ન ટાકર અને તેમના ધર્મપત્ની શિવાનંદ આશ્રમ ખાતે રહીને અષ્ટદેવી પૂજન, કન્યાના પૂજન અને ગરબાનો લાભ લીધો છે.

**ઘેડબ્રહ્મા :** પૂજયપાદ શ્રીમત્ સ્વામી શુરૂકૃપાનંદજી મહારાજશ્રીનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહે છે, તેથી તેમના સુખ સમાચાર જાણવા અમદાવાદથી તા. ૧૦મીના રોજ પૂજયપાદ શ્રીમત્ સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, સ્વામી શુરૂસેવાનંદજી, સ્વામી નારાયણસ્વરૂપાનંદજી, સ્વામી રાધવાનંદજી મહારાજ ઘેડબ્રહ્મા પદ્ધાર્યા. સત્સંગ થયો. ગામલોકને રાજ્યપો થયો.

**દિલ્હી :** શ્રીમતી માલતી સીંગલ અને તેમના સુપુત્ર શ્રી મનોજ સીંગલના નિમંત્રણે નવરાત્રીની પવિત્ર મહાઅષ્ટમીની સાંજે પૂજયપાદ શ્રીમત્ સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ દિલ્હી પદ્ધાર્યા. શ્રી મા જગંબાના ગુણગાન પંજાબી પરંપરામાં ‘ચોકી’ અખંડ જ્યોત સમક્ષ થયાં. આ પ્રસંગે કેન્દ્ર સરકારનાં સૂચના અને પ્રસાદાણ મંત્રી અંબિકા સોની પણ ઉપસ્થિત રહ્યાં.

**વડોદરા :** ગુજરાત જેજસની ઝોનલ કોન્ફરન્સ તા. ૨૭/૨૮ ઓક્ટોબરના રોજ વડોદરાની ઉર્મા એક્સ્યુપ્રેશન સોસાયટીના પ્રાંગણમાં પૂજયપાદ શ્રીમત્ સ્વામી અધ્યાત્માનંદજીના Keynote એટ્રેસ સાથે આપ્યોજાયું. તા. ૨૮મીની સાંજે અતે પૂજય સ્વામીજનું વક્તવ્ય ‘Udan of India in modern world’ થયું. તા. ૨૮મીની સવારે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના ઉપક્રમે ‘તમારી ક્ષમતાને પ્રકાશમાં લાવો’ અને ‘જંખીએ સાથ પરસ્પર ભવેભવનો’ એમ બે પ્રવચનો થયાં.

વડોદરાના નિવાસ દરમિયાન પૂજય સ્વામીજાને અનેક ભક્તોને ત્યાં પદ્ધરામણી કરી અને સૌને દિલ્હી પવિત્ર લાભ આપ્યો.

## નાજર કૂટસ્થ આત્મા પર રાખો

‘પોતાની જતને છ ઉર્મિઓ (જન્મ, મરણ, ભૂખ, તરસ, સુખ અને દુઃખ)થી અલગ રાખવી જોઈએ. છે છ સંસારસાગરના તરંગો છે. જન્મ-મરણને બોલિક શરીર સાથે સંટંધ છે. ભૂખ-તરસને પ્રાણ સાથે સંટંધ છે. સુખ અને દુઃખ મનને લાગોલાં છે. આત્મા અસંગ, કૂટસ્થ, સર્વલ્યાપક અને છ ઉર્મિઓથી અસંગ છે. મન, પ્રાણ અને છન્દ્રયોની રમતને સાક્ષીભાવે નિહાળો, તેની રમતમાં સામેલ ન થાઓ.’

- સ્વામી શિવાનંદ

## શાશ્વત સંદેશ

### ગુરુદેવને અનુસરો

જ્યારે માનવ-વ્યક્તિ ભગવત्-સાક્ષાત્કાર પામે ત્યારે તે વ્યક્તિ પોતાની ચિદ્ધ અવસ્થા તેમજ તેણે જે દિવ્યતા પ્રાપ્ત કરી હોય તેની અભિવ્યક્તિ કઈ રીતે કરે ? ગુરુદેવ ભગવાન શિવાનંદજીના વ્યક્તિત્વ કારા આ ભાગાતનો આવિલાસ આપણાને મળો છે. ગુરુદેવનું વ્યક્તિત્વ, તેમનું વર્તન, તેઓ કેવા આદર્શ પુરુષ હતા અને તેમનું ઝુવળ કેવું દિવ્ય હું તે સમજવા પ્રયત્ન કરો. ગુરુદેવ તમારો આદર્શ તથા દિન-પ્રતિદિન દ્યાન કરવા માટેનું પાગ બનો ! તમારી માનસિક દંડિ સમક્ષ હરહંમેશ તેમને રાખો, જેથી તે તમારી સામેના પથને પ્રકાશિત કરે, તમને આકર્ષે, તેમના સ્તરે તમને લઈ જઈ ઉન્નત કરે. આને તમારી સર્વલ્યાપી, મહાન સાધના બનાવો.

- સ્વામી શિવાનંદ